

જિન મૂર્તિ અનેક દિનો !

પદ્માસનમાં, પાષાણમાં, વર્તમાન ચોવીશીની, કાઉસ્સગ મુદ્રામાં, પરિકર સહિત, અષ્ટ પ્રાતિહાર્ય સહિત, અશોકવૃક્ષ સહિત, અર્ધ પદ્માસનમાં, પંચ ધાતુમાં, પંચ તીર્થરૂપે, ચોવીશી રૂપે, ધરણેન્દ્ર પદ્માવતી સહિત, રફ્ટિક રત્નમાં, હાથી દાંતમાં, ચંદનમાં, સુવર્ણમાં, ૨જતમાં, શાશ્વત જીવની, ૨૦ વિહરમાનની, ભાવી તીર્થકરની, સહખ્ખુટ રૂપે, ચરણ પાદુકા, ગ્રણતીર્થરૂપે, એક તીર્થરૂપે.

પૂજના પ્રકાર :

૧. અષ્ટ પ્રકારી પૂજા :

- (અ) વિઘ્નોનો નાશ કરનારી - અંગ પૂજા. ૧ જલ, ૨. ચંદન, ૩. પુણ્ય.
- (બ) અભ્યુદય શોધીની - અગ્રપૂજા. ૪. ધૂપ, ૫. દીપ, ૬. અક્ષત, ૭. નૈવેદ્ય, ૮. ફળ.
- (ક) નિવૃત્તિ - મોક્ષ પદ દાતા- ભાવપૂજા, ચૈત્યવંદન, દેવવંદન, સ્તુતિ વિ.

૨. ૧૭ પૂજના પ્રકાર :

- ૧. ન્હવણ, ૨. વિલેપન, ૩. વખ્યુગલ (ચક્ષુયુગલ), ૪. ગંધપૂજા, ૫. પુણ્યારોહણ, ૬. પુણ્યમાલા, ૭. અંગરચના, ૮. ચૂર્ણપૂજા, ૯. ધજપૂજા, ૧૦. આભરણપૂજા, ૧૧. પુણ્ય ગૂહ, ૧૨. પુણ્ય વર્ષણ, ૧૩. અષ્ટમંગલ, ૧૪. ધૂપ પૂજા, ૧૫. ગીતગાન, ૧૬. નાટક, ૧૭. વાઢુંત્ર.

૩. એકવીસ પ્રકારી પૂજા :

- ૧. સ્નાત પૂજા, ૨. વિલેપન પૂજા, ૩. આભૂષણ પૂજા, ૪. પુણ્ય પૂજા, ૫. વાસક્ષેપ પૂજા, ૭. દીપક પૂજા, ૮. ફળ પૂજા, ૯. અક્ષત પૂજા, ૧૦. પાન પૂજા (નાગરવેલ), ૧૧. સોપારી પૂજા, ૧૨. નૈવેદ્ય પૂજા, ૧૩. જળ પૂજા, ૧૪. વખ્ણ પૂજા, ૧૫. ચામર પૂજા, ૧૬. છત્ર પૂજા, ૧૭. વાઢુંત્ર પૂજા, ૧૮. ગીત પૂજા, ૧૯. નાટક પૂજા, ૨૦. સ્તુતિ પૂજા, ૨૧. ભંડાર વર્ધન પૂજા.

જિન મંદિરના પ્રકારો :

- ★ શિખરબંધી, ધુમટબંધી, સામરણાલું, ધર દેરાસર, ગુરુમંદિર, અધિજાયકનું મંદિર અનેક સ્થળે છે.
- ★ ત્રણ શિખરી- ધાટકોપર, ચેમ્બુર, વાસી, કાંદિવલી, આદિ સ્થળે.
- ★ ૭૨ જિનાલય - કચ્છમાં, હસ્તગારી વગેરે સ્થળે.
- ★ ૫૨ જિનાલય - શંખેશ્વર, રાતેજ, નિપાણી વગેરે સ્થળે.
- ★ આગામ મંદિર - પાલીતાણા, શંખેશ્વર, સુરત, કાત્રજ (પૂના) વગેરે સ્થળે.
- ★ જળમંદિર - પાવાપુરી, ગુણીયાજી, સમેતશિખરજી, શાનુંજ્ય.
- ★ શાશ્વતા મંદિર - દેવલોકમાં.
- ★ સમવસરણ - પાવાપુરી, શાનુંજ્ય તિર્થ, અગાસી.
- ★ અષ્ટાપદજી - શાનુંજ્ય તીર્થ.
- ★ નવપદજનું - થાણા, પૂના.

★ કાજનું - તારંગાતીર્થ (અગર, તગરના કાજનું) પ્રાચીન મંદિર, સૂરત, ખંભાત.

★ વિશાળ મંદિર - હસ્તગિરિ, મહેસાણા.

★ ૧૪૪૪ સ્થંભ મંદિર - રાણકપુરજી, દેવવિમાન જેવું મંદિર.

★ કીર્તિ સ્થળ - ચિત્તોડગઢ, શાનુંજ્ય તિર્થ.

★ નંદીશ્વર દ્વિપ - જાલોર, પાલીતાણા.

★ નવ ગભારાવાલું - પ્રભાસ પાટણ, સૂરત.

★ ભક્તામર મંદિર - ભરૂચ.

★ ત્રણ-ચાર માળવાલું - ઘાટકોપર, પાલીતાણા.

★ ૧૦૮ જિનાલય - શાંબેશ્વર, શાનુંજ્યતિર્થ, દેવાચી આળંદી. (પૂના)

તીર્થકરનાર આત્માનો પ્રભાવ :

૧. ધર્મચક : મિથ્યાત્વી માટે સૂર્ય, સમ્યગ્ દાણિ માટે અંજન, તીર્થકરની લક્ષ્મી, તિલકરૂપ.

૨. ઈન્દ્રધવજ : વીતરાગ જ એક સ્વામી છે. એ વાત યાદ કરાવવા.

૩. સુવર્ણ કમળ : લક્ષ્મી તીર્થકર ભ.ના ચરણે વાસ કરે છે.

૪. ચારમુખ : દાનાદિ ચાર પ્રકારના ધર્મને પ્રરૂપણા કરનાર.

૫. ત્રણગઢ : રાગ, દ્રેષ, મોહરૂપ દોષથી બચવા.

૬. કંટક : ધુવડ સૂર્યને જોઈ મુખ ધૂપાવે તેમ મિથ્યાત્વી દુર્જનને યાદ કરાવવા.

૭. ઉગે નહિ : કેશ, રોમ, નખ શમશ્રૂ, દાઢી-મૂછના વાળ સંયમ બાદ ન વધે.

૮. પાંચ વિષય : ખડ દર્શનની જેમ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિ, વિષય પ્રતિકૂળ ન થાય.

૯. ખડત્રાતુ : તીર્થકર પરમાત્માની પાસે છ એ ઋતુઓ સેવા કરવા રૂપ વિષયોને વિકસાવે.

૧૦. જળસુગંધ : તીર્થકર પરમાત્મા જ્યાં વિચરે એ ભૂમિને સુગંધિત જળથી દેવતા પવિત્ર કરે.

૧૧. પક્ષી : પક્ષી પણ પરમાત્માને પ્રદક્ષિણા આપે તો મનુષ્યની વાત જ શી ?

૧૨. પવન : વાયુકુમારના દેવ પવનને અનુકૂળ સુગંધમય બનાવે તો પંચેન્દ્રિયની દુષ્ટતા રહે જ કેમ ?

૧૩. વૃક્ષ : વૃક્ષ પણ નભી ધન્યતા અનુભવે તો મિથ્યા દાણિના મસ્તક વર્થ છે.

૧૪. દેવ : કોડો દેવો, ઈન્દ્રો સેવા કરે.

★ તીર્થકર ભ. અને ભક્ત વચ્ચેના સંબંધ સર્વમથમ દાસ (દાસત્વ) ભાવે જન્મે બાદ મિત્ર ભાવે કાળકમે પરિણમે અને અંતે સોડહમના જેવા વિચારોથી પૂર્ણતાને પામે. -વીતરાગ સ્તોત્ર

રત્નાત્રયીના ઉપકરણા :

દર્શન (જિન મંદિરમાં વપરાતી વસ્તુ)

ધૂપધાણું, દિપક, દર્પણ, પંખો, ચામર, ઘંટ, છત, સિંહાસન, ભંડાર, વાળાંચી, અંગલુદ્ધણા, કળશ, પાટલુંધણા, મોરપીછી, વાટકો, વાટકી, થાળી, થાળ, બરાસ, કેસર, વાસક્ષેપ, વરખ, કુંડી, ચંદનતેલ,

આરતી, મંગળદીવો, ધંટડી, પુજની, પૂજાના વસ્ત્ર, સુખડ, અગરબાતી, દીવો, ફાનસ, નાહાણી, ચંદરવો, પુરીયું.

જ્ઞાન (જ્ઞાન પ્રાપ્તિમાં ઉપયોગી થતી વસ્તુ)

પાટી, પોથી, પાટલી, સાપડો, દસ્તરી, વહી, ઠવણી, કવલી, ઓળીયું, નવકારવાળી, પેન, ત્રિપાઠી, પંચપાઠી, વીઠણી, પેન્સિલ, રબ્બર, હુટપછ્છી, નોટબુક, ડાયરી, કાગળ, શાહી, પુસ્તક.

ચારિત્ર (સંયમ ધર્મના પાલનમાં જરૂરી વસ્તુ)

ચરવલો, મુહૃપત્તી, કટાસણું, સ્થાપનાચાર્ય, દાંડી, દાંડો, દંડાસણ, કામળી, સંથારીયું, આસન, ઓઘો (રજોહરણ), સુપડી, પુંજણી, ઘાલો, ઉત્તરપછો, ચોળપછો, ચાદર (કપડા), પાતરા, ચેતનો, પાટો, પાટ, સાડો, લોટ, સામાયિકના વસ્ત્ર, સ્થાપના.

જ્ઞાન મંદિરની આશાતના :

(અ) જધન્ય = દેરાસરમાં ૧. પાન સોપારી ખાવું, ૨. પાણી પીવું, ૩. ભોજન કરવું, ૪. જોડા બુટ પહેરી જવું, ૫. સ્વી ભોગ કરવો, ૬. શયન કરવું, ૭. થુંકવું, ૮. પેશાબ કરવો, ૯. જુગાર રમત કરવી.

(બ) મધ્યમ = ૧ થી ૧૦ ઉપર પ્રમાણે. ૧૧. ઝુ-માંકડ વિષવા- જોવા, ૧૨. વિકથા કરવી, ૧૩. પલાઈવાળી બેસવું, ૧૪. પગ લાંબા કરી બેસવું, ૧૫. પરસ્પર વિવાદ કરવો, ૧૬. હાંસી કરવી, ૧૭. ઈર્ખ કરવી,

૧૮. ઉચ્ચાસને (સિહાસન, પાટ, પાટલા વિ.) બેસવું, ૧૯. વાળ શરીરની શોભા કરવી, ૨૦. છત ધરવું, ૨૧. તલવાર વિ. રાખવું, ૨૨. મુગટ રાખવો, ૨૩. ચામર ઢાળવવા, ૨૪. લેણદારને પકડવા, ૨૫. સ્વિ.વિ.સાથે હાસ્ય વિનોદ કરવો, ૨૬. પાના - ગંજફો વિ. રમત રમવી, ૨૭. મુખ કોશ બાધ્યા વિના પૂજા કરવી,

૨૮. મલીન શરીરે વસ્તે પૂજા કરવી, ૨૯. ચંચળ ચિત્તે પૂજા કરવી, ૩૦. મંદિરમાં ગ્રવેશતા સચિત વસ્તુનો ત્યાગ ન કરવો, ૩૧. અચિત્ત પદાર્થો શોભાકારી હોય તેને દૂર કરવા (દાંગના વગેરે), ૩૨. અખંડ વસ્તુનું ઉત્તરાસણ પહેર્યા વગર જવું, ૩૩. પ્રભુ પ્રતિમાં દેખવા છતાં હાથ ન જોડવા, ૩૪. શક્તિ છતાં પૂજા ન કરવી,

૩૫. ચઢાવવા યોગ્ય ન હોય તેવા દ્રવ્ય પદાર્થોથી પૂજા કરવી, ૩૬. ભક્તિ-બહુમાન- આદર વગરની પૂજા કરવી, ૩૭. નિંદા કરતી વ્યક્તિને રોકવા નહિ, ૩૮. દેવદ્રવ્યનો નાશ થતો હોય ત્યાં ઉપેક્ષા કરવી, ૩૯. દેરાસર શક્તિ છતાં વાહનમાં બેસી ગયા, ૪૦. પૂજા ચૈત્યવંદન આગળ પાછળ કર્યું.

સાધુ-અનેક ધર્મના :

હિન્દુ - સાધુ, બાવા, જોગી, જોગીયા, સન્યાસી, હઠયોગી, સંત, મહંત, મધાવિશ, તાપસ.

ધ્રિસ્તી - પાદરી, નન્સ.

મુસ્લિમ - ફકીર, મૌલવી.

જૈન - મુનિ, મહાત્મા, ત્યાગી, જ્ઞાની, આધત્મયોગી, તપસ્વી, આચાર્ય, ઉપાધ્યાય, ગણિ, પન્યાસ, પ્રવર્તક, સાધુ.

સ્થવિર - આચાર્યના પ્રકાર :

(અ) સ્થવિર મુનિ :

શુતસ્થવિર - ચોથા સમવાયાંગ સૂત્ર સુધીના જ્ઞાતા.

પર્યાયસ્થવિર - ૨૦ કે તેથી વધુ વર્ષના દીક્ષા પર્યાયવાલા.

વયસ્થવિર - ૭૦ કે તેથી વધુ વર્ષની ઉમરવાલા.

(બ) આચાર્ય :

પ્રવર્જિકાચાર્ય - સંયમ, દિક્ષા, પ્રતોષ્યાર આપનાર.

ઉદેશાચાર્ય - પ્રથમથી જ સૂત્રનો ઉદેશ કરે (કહે)

વાચનાચાર્ય - આગમસૂત્રની વાચના -પાઠ આપનાર.

દિગાચાર્ય - સચિત-અચિત, મિશ્રવસ્તુ સંયમાર્થે લેવા વાપરવાની અનુજ્ઞા આપનાર.

સમુદેશાનુજ્ઞાચાર્ય - ઉદેશાચાર્યના અભાવે તેજશુત્રનો અર્થ ભણાવે સુત્રને સ્થિર કરવાનું કહે અને બીજાને ભણાવાની અનુજ્ઞા આપે.

આભાનાચાર્ય - ઉત્સર્ગ, અપવાદરૂપ અર્થને સમજવનારા, ઉપકારી ગુરુ યોગ્ય સાધુને સ્થાપનાચાર્ય અને આસનની અનુજ્ઞા આપે.

(ક) ઉપાધ્યાય :

હાથી, ઘોડો, ઋષભ, સિંહ, વાસુદેવ, ઈન્દ્ર, સૂર્ય, ચંદ્ર, ભંડારી, જંબુવૃક્ષ, સિતાનદી, મેરુ પર્વત, સ્વયંભૂરમણ, સમુદ્ર, રત્ન, ભૂપ વગેરે ઉપમાથી યુક્ત.

(દ) સાધુ (અનુયોગ દ્વારા)

સર્પ, પર્વત, અઞ્જિન, સાગર, આકાશ, વૃક્ષ, ભ્રમર, હરણ, પૃથ્વી, કમળ, સૂર્ય, પવન વગેરે ઉપમાવાલા.

(ઈ) ગુરુ (સાધુ) :

નીલ સમાન, કૌચ્યપક્ષી સમાન, ભમરા સમાન, મોર સમાન, ક્રોયલ સમાન, હંસ સમાન, પોપટ સમાન.

વૈચાવચ્છ્ય પાત્ર :

આચાર્ય : સંધના વડા, ત્રીજા પદે બિરાજમાન.

ઉપાધ્યાય : આચાર્યની આજ્ઞાથી જેની પાસે સાધુ ભણે.

તપસ્વી : અદૃમ કે તેથી વધુ તપ કરનાર.

નવદિક્ષિત : (કૈક્ષક) આચારના અજ્ઞાત જાણકાર ન હોવાથી.

જ્લાન : જવરાદિ રોગવાળા અશક્ત સાધુ.

સ્થવિરાદિ : અન્ય વર્દિલ બંધુ.

સમનોજા : એક જ સમાચારી વાળા અન્ય ગર્ભીય સાધુ.

સંઘ : સાધુ, સાધી, શ્રાવક, શ્રાવિકા.

કુલ : ધર્મા આચાર્યથી યુક્ત પરિવાર.

ગણ : એક આચાર્યનો પરિવાર.

માત્ર ગુરુ સંબંધી ઉપયોગી થતા સૂત્રો :

પંચિદિય સૂત્ર : ગુરુની સ્થાપના સ્થાપતા બોલાતું સૂત્ર.

ઈચ્છામિ ખમા. : ગુરુને પંચાંગ મણિપાત વંદન કરતાં બોલાતું સૂત્ર.

ઈચ્છકાર : ગુરુને સુખશાતા પૂછવા માટે બોલાતું સૂત્ર.

અભ્યુહીઓ : ગુરુની જાણતા, અજાણતા થયેલ અશાતના (૧૦ પ્રકારની અપીતિ) તે વર્ણવી તે બદલ મિચ્છામી દુક્કડ મંગાય છે.

વાંદળા : દ્વાદશાવર્ત વંદનમાં આ સૂત્ર દ્વારા ગુરુની (પદસ્થ આચાર્ય) થયેલ ઉત્ત આશાતના માટે ક્રમા મંગાય છે.

જાવત કે વિ : સાધુ મહારાજ ભરત, ઔરાવત, મહાવિદેહ (અઠીદ્વિપ) ક્ષેત્રમાં બિરાજે છે. તેવું જ્ઞાન આ સૂત્રથી થાય છે.

અદ્ધાઈજ્જેસુ : ગુરુઓ ૧૮ હજાર શિલાંગના ધારક છે. તેવું આ સૂત્ર બતાવે છે.

આચરિય ઉવ. : ગુરુના પ્રકારો અને તેઓ પ્રત્યે થયેલ કષાયની ચર્ચા આ સૂત્ર કરે છે.

ભુવન દેવતા સ્તુતિ : જ્ઞાનાદિ ગુણોમાં મળન એવા સાધુજનોને થતા ઉપદ્રવો દૂર કરવા દેવતાને સ્મરણ રૂપ આ સૂત્ર છે.

ક્ષેત્ર દેવતા સ્તુતિ : સાધુ જે ક્ષેત્રમાં આરાધના કરે છે તેમણે સહાયરૂપ થવા માટે.

ગુરુવંદન ભાષ્ય : ગુરુને વંદના કરવાની પદ્ધતિ, લાભ, નુકસાન, આશાતનાના વિચારો બતાડનાર સૂત્ર.

સંયમીના ઉપકરણા :

ઓધા = આ છે ઓધો, તે મોંધો, વૈરાગીને મન સોંધો.

દંડસણ = આ છે દંડસણ, જીવોને ન થાય વિમાસણ (દુઃખ).

સંથારો = આ છે સંથારો, ખરેખર મોક્ષ માર્ગનો સથવારો.

આસન = આ છે આસન, મોક્ષ માર્ગનું (પ્રામિનું) સિંહાસન.

વેષ = આ છે વિરતિ ધર્મના વેષની વાત, દેવો જંબે તો પણ ન મળે એક રાત.

ચરણ = આ છે પવિત્ર ચરણ, કરવું જોઈએ આત્મસમર્પણ.

પાત્રા = આ છે ગૌતમસ્વામીના પાત્રા, જેથી સુખે પળાય સંયમયાત્રા.

મુહુપત્તી = આ છે મુહુપત્તી, મોક્ષ માર્ગની બતી.

ચરવળી = આ છે ચરવળી, જીવદ્યાનું પાલન કરાવે સવળી.

તરપણી = આ છે તરપણી, તેમાં લવાય ફાસુક-નિર્દોષ આહાર પાણી !

નવકારવાળી = આ છે નવકારવાળી, જ્યાતાં જીવનને દે અજવાળી.

પોથી-શાસ્ત્ર = આ દે પોથીશાસ્ત્ર, વાંચતા વંદતા જીવન થાય પાત્ર.

લેવા જેવું સંયમ. ત્યાજવા જેવો સંસાર. પ્રાત કરવા જેવું મોક્ષ.

ગુરુ વંદનથી ફાયદા :

૧. સદ્ગુરુનો સમાગમ. પુષ્ય - પાપનો રસ્તો બતાવે.
 ૨. સદ્ગુરુની વૈયાવચ્ચ સંસાર સમુદ્ર તરવા ભૂજાસમાન.
 ૩. સદ્ગુરુના થોગે કૈન શાસન આખંડિત રહ્યું છે.
 ૪. સદ્ગુરુની સેવાથી સહધર્મ એક સાંકળે બંધાઈ રહે છે.
 ૫. સદ્ગુરુની દેશના સાંભળવાથી મોહનિદ્રામાં પડેલ આત્મા જગૃત થાય છે.
 ૬. સદ્ગુરુના સહવાસથી વિનય, વિવેક, ક્ષમા, ઉદારતાદિ ગુણો જીવનની ઉત્ત્રતિના પ્રાત થાય.
 ૭. સદ્ગુરુને વંદન, ભક્તિ, સત્કાર વિ. કરવાથી ઉચ્ચગોત્રનો બંધ થાય, સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ થાય.

આ છે ધાર્મિક જ્ઞાન આપણાશી પાઠશાળા :

સમ્યગુ જ્ઞાનનું અમૃતપાન કરાવનારી : માતા.

મનુષ્ય જન્મની દુર્લભતા સમજાવનાર વિદ્યાદાતા : શિક્ષિકા.

ધાર્મિક સંસ્કારોનો પ્રચાર કરનાર : કેન્દ્ર.

સત્કાર્યોનું પ્રેરણાબળ આપનારી જ્ઞાનગંગોતરી : સરિતા.

અહિસાદિ માનવતાના પાઠ શિખવાડનાર : શિક્ષાકેન્દ્ર .

શાશ્વત સુખ, આત્માને આત્માના સ્થાને પહોંચાડનારી : ૮

પંચમગતિ - શિવસંદર્ભીનો સંદેશો લાવનારુ : પોસ્ટમેન.

અગાધ એવા ભવસાગરથી ભવિજ્જવને તરાવનાર : નાઓ

અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાતા-હિતાતા જીવોને અસ્યમાર્ગે :

ભાવિતા અહિત ચંદ્રાન જન્મ-મરણની વાટિ ખતાડાર : દર્શિન

ਅੰਮ੍ਰਿਤਸੰਗ ਪ੍ਰਾਪਤੇ ਹੋਣਾ : ਸ਼ਿਖੀ

11-31-13 2013 143 112 310

1995-ലെ സ്കോറിൽ നാലു മുതൽ ഒരു വർഷം മുമ്പ് നിന്ന് അപേക്ഷിച്ച ഫോറ്റോഗ്രാഫ് എന്ന് പറയുന്നു.

“ అంత క్రూరుక్కున్న కు “ తిథిల్లా

16 8 16

କିମ୍ବା, କିମ୍ବା, କିମ୍ବା କିମ୍ବା: କିମ୍ବା.

આત્માન, શરારન જિન્હે જતાડનાર છૂટા પાડનાર. રાઠહસપક્તા..

સદાચાર સદ્વિચારની : નિધિ.

સમુદ્રના કિનારે વિકસેલી મીઠા મધુરાજળની : મીઠીવિરડી.

સુખ ભોગવવાનું અને દુઃખને સમભાવે સહન કરાવનારું : જ્ઞાનતીર્થ.

દુઃખી, નિરાશ, પાપના ઉદ્યવાળા, ધ્યેયહીન જીવો માટે : દિવાદંડી.

પ્રશ્ન નવ, જવાબ માત્ર એક :

૧. હું જ્ઞાનનું આધુનિક ઉપકરણ-સાધન છું.
 ૨. હું બાળકોને શુદ્ધલેખન-ચિત્રકામમાં ઉપયોગી થાઉં છું.
 ૩. હું એકેન્દ્રીય જીવનું કલેવર છું.
 ૪. વનસ્પતિકાય મારું મૂળ (જન્મ) સ્થાન છે.
 ૫. કારખાનું મારો વિકાસ કરનારી જન્મ ભૂમિ છે.
 ૬. સ્ટેશનરીની દુકાનમાં હું મળું છું.
 ૭. ત્રણ-ચાર સાઈઝમાં મારી હસ્તી હોય છે.
 ૮. મારી સાચવણી કરો તો જ્ઞાનની આરાધના કરનાર ગણાશો.
 ૯. કોઈને મારવા માટે મારો ઉપયોગ કરશો તો જ્ઞાનના વિરાધક થશો.
- બસ, હવે બતાડો મારું જૂનું-નવું નામ. જવાબ : રૂલ, ફુટપણી.

પ્રશ્ન એક જવાબ અનેક :

(અ) ૧. સરોવર નથી પાણી કયાંથી લાવું ?

૨. બાળ નથી શિકાર કેમ કરું ?

૩. સ્વર મધુર અવાજ નથી કેમ ગાવું ? જવાબ : “સરોનથી.”

(બ) ૧. હરિ આયો, ૨. હરિ ઉપન્યો, ૩. હરિ પૂછે હરિ થાય, ૪. હરિ ગયો, હરિના વિષ, ૫. હરિ બેઠો વા ખાય.

અર્થ : ૧. વરસાદ આયો. ૨. દેડકા ઉત્પન્ન થયા. ૩. દેડકાં પાછળ સર્વ દોડે છે. ૪. દેડકો તે કારણે કૃષણ પાસે ગયો. ૫. નિરાશ થઈ સર્વ બેસી ગયો.

આવશ્યક સૂત્રોનો ઉપયોગ કરતાં :

મુદ્રા બતાડાય છે.	ધ્યાન કરાય છે.	પ્રતિજ્ઞા લેવાય છે.
જાપ કરાય છે.	શાંતિની ઉદ્ઘોષણા થાય છે.	વંદના થાય છે.
પ્રાયચિંહ મંગાય છે.	ક્ષમા મંગાય છે.	પ્રાર્થના કરાય છે.
સમૂહમાં સૂર પુરાય છે.	વિષ થાય છે.	ધૂટણાટ મંગાય છે.
સ્થાપના સ્થપાય છે.	સ્થાપના ઉત્થાપન થાય છે.	બહુમાન થાય છે.

પાઠશાળામાં ભણાવતા સ્ફોરો :

સામાયિકના	ચૈત્યવંદનના	દેવવંદનના	બે પ્રતિકમણના
પાંચ પ્રતિકમણના	ચાર પ્રકરણ	ત્રણ ભાષ્ય	છ કર્મગ્રંથ
લઘુ સંગ્રહણી	બૃહૃત્ સંગ્રહણી	તત્વાર્થ	ક્ષેત્ર સમાસ
યોગશાસ્ત્ર	વૈરાગ્ય શતક	સિંહુર પ્રકરણ	જ્ઞાનસાર

પાઠશાળામાં ભણેલા સ્ફોરોથી કરતી શુલ્ભકિયા :

સામાયિક	ગુરુવંદન	ચૈત્યવંદન	દેવવંદન
ફેટાવંદન	દ્વાદશાવર્તવંદન	પौષ્ઠ્ર	દેસાવગાસીક
અતિથિ સંવિભાગ	પાંચ પ્રતિકમણ	રાઈમુહપત્તી	સંથારા પોરીસિ
માંડલા	પોરસી	પચ્ચકખાજાપારવું	ઉપધાન
વાંચન	નાણનીકિયા	પઢિલહેણા	ગમણા ગમણે

પરસ્પર વિરોધી શબ્દો :

જીવ-અજીવ	જન્મ-મરણ	પુણ્ય-પાપ
આસ્ટિક-નાસ્ટિક	આશ્રવ-સંવર	આરાધક-વિરાધક
બંધ-નિર્જરા	ત્રસ-સ્થાવર	સચિત-અચિત
રાગ-દ્રોષ	ધાતિ-અધાતિ	સુખ-દુઃખ
હિંસા-અહિંસા	રૂપી-અરૂપી	સમકિત-મિથ્યાત્વ
પ્રસંશા-નિંદા	જ્ઞાની-અજ્ઞાની	શરીરી-અશરીરી
વિરતિ-અવિરતિ	ભોગી-યોગી	મુક્ત-સંસારી

સ્વરની ગેરહાજરીમાં અર્થબદલે :

અ	અહિંસા-હિંસા	અક્ષય-ક્ષય	અવિરતિ-વિરતિ
	અજીવ-જીવ	અમંગળ-મંગળ	
આ	સાગર-સગર	ચારિત્ર-ચરિત્ર	રાજી-રજ
	જાતિ-જતિ	શાસ્ત્ર-શાસ્ત્ર	
ઇ	જીવ-જવ	દીન-દાન	દીક્ષા-દક્ષા
ઉ	પૂર-પર	ભૂમિ-ભમિ	સૂત્ર-સત્ર
	મૂળ-મળ		પૂત્ર-પત્ર
એ	દેવ-દવ	કૃળા-કળા	મેના-મના
			દેવા-દવા

વેદ-વદ

એ	જૈન-જન	બૈલ-બલ
ઓ	મૌન-મન	ગૌન-ગન
અં	ઉદર-ઉદર	ચિંતા-ચિતા વંદન-વદન અંધિયતામ-અધિયતામ

ગણિત, વ્યાકરણના ચિન્હ અને તત્ત્વબોધ :

; અર્ધવિરામ	- ધણું જીવનમાં દોડ્યા; હવે થોડું રોકાઈ જાઓ.
. પૂર્ણવિરામ	- બીજે ક્યાંય ન શોધો. અનંત જ્ઞાન તમારામાં જ છે.
? પ્રશ્નાર્થ	- આટલા જન્મ-મરણ, આરંભ-સમારંભ કર્યા શું વળ્યું ?
! ઉદ્ગાર ચિન્હ	- સુકૃતના કાર્યોમાં, કામોમાં સંતોષ ન રાખો. બસ આટલું જ !
‘ ’ અવતરણ ચિન્હ	- ‘બુઝ બુઝ ચંડકૌશિક’
, અલ્પવિરામ	- દર્શન, પૂજા, ચૈત્યવંદન, ગુરુવંદન, સામાયિક કરો.
() બ્રેકેટ	- જીવનમાં દાનાદિ ધર્મનું (ભવાથી, વિવેકથી, શ્રદ્ધાથી) અવશ્ય પાલન કરો.
X ગુણાકાર	- પાપકર્મના ઉદ્ય વખતે સમતા રાખો. આર્તથાનથી નવું કર્મ બંધાશે.
હું ભાગાકાર	- ધ્યેય શૂન્ય જીવનના વર્ષો, મહિના, દિવસ પૂરા કર્યા. બાકીમાં શું રહ્યું ?
- બાદબાકી	- જીવનમાંથી દુષ્કર્મ પાપની બાદબાકી કરનારા જ ધન્ય બને.
= સરવાળો	- ચારગતિમાં ફરી મનુષ્ય ગતિમાં આવ્યા. હવે સરવાળો કયાં જવું છે ?
ં વૃદ્ધિ	- ફરી જન્મ-મરણ વધારવા હોય તો પાપની વૃદ્ધિ કરો.

અક્ષર બને છે અંક (સંખ્યા) :

ક્રપાંનું નામ : મલમલ ૪॥૯॥૯॥૯॥૯ = ૨૭ સાધુના ગુણ

આત્માનું નામ : પરમાત્મા ૫ રૂ ૨ રૂ ૪॥૯॥૮ રૂ ૪॥ = ૨૪ તીર્થીકર.

સિદ્ધપદને પામેલ આત્મા : રામ રા રૂ ૪॥ = ૬॥

અજ્ઞાની જીવમાં ધર કરેલા વિચાર : હું ૮ રૂ ૮ રૂ ૭ = ૨૪ દિવસના કલાક.

અગ્રિય વ્યક્તિ : લ૫ ૮॥૯ = ૧૪।

ભગવતી સૂત્રને જયદુંજર હાથી સાથે સરખાભળી :

જ્ય કુંજર હાથી	વિવાહ પત્રનિ (ભગવતી સૂત્ર)
મનોહર ચાલ	પદની પદ્ધતિમાં લાલિત્ય
અચળ નિર્ભય	ધર્મનું સ્વરૂપ
સુંદર કણ્ઠપ્રીય, અવાજ, ગાંભીર્ય	ગંભીર મધુર ધ્વનીમાં વ્યક્ત થાય તેવો ગ્રંથ
લીંગસહિત	લીંગ વિભક્તિ સહિત શાસ્ત્ર

શ્રેષ્ઠ લક્ષણવાળો	ઉત્તમ લક્ષણોથી યુક્ત
દેવતા અધિકૃત	શ્રુત દેવતા અધિકૃત, મહિમાવંત
સુવર્ણ અલંકૃત (આભૂષણથી)	સુવર્ણ મંદિર દેહ (પ્રત) સુવર્ણ પૂજિત ગ્રંથ
અદ્ભૂત ચરિત્ર	શ્રેષ્ઠ સર્વોત્તમ કથાઓ
પ્રમાણોપેત દેહ	તે હજાર પ્રશ્ન સહિત સૂત્ર
ચાર ચરણ	ચાર અનુયોગ દ્વારા
બે નયન યુગલ	જ્ઞાન ચરણ (દેખાડનાર અને દોરનાર)
બે દંત મુશલ	દ્વય પર્યાય નય
બે ગંડ સ્થળ કુંભ	નિર્ણય વ્યવહાર દાટિ
બે કર્ણ યુગલ	યોગ ક્ષેમ
વિશાળ સૂંઠ	સુદીર્ઘ પ્રસ્તાવના
અતુચ્છ પૂચ્છ	સાર ગર્ભિત વચન
અષ્ટ પરિવાર	જ્ઞાનાચારાદિ પરિચય કરાવે.
દશે દિશામાં પડહ	યસગાથા પ્રસારણ
મંગલ ચતુર્ઝ ઘંટ	ઉત્સર્ગ અપવાદ (સિદ્ધાંત)
અંકુશ	સ્યાદ્વાદ સિદ્ધાંત
શાખ સંપુટ	દેતુરૂપ શાખ
શમુ માટે અજ્ય	આત્મ શત્રુ માટે નિયુક્ત

તિથી અને શુલ્ષ દિવસ :

- ૧. નૂતન વર્ષ
- ૨. ભાઈબીજ
- ૩. અખાતીજ
- ૪. સંવત્સરી
- ૫. સૌભાગ્યપંચમી જ્ઞાનપાંચમ
- ૬. છૃદ્ધિતિથી ભગવાન મહાવીર સ્વામી
- ૭. શાશ્વતિ ઓળિનો પ્રારંભ
- ૮. વર્ષીતપની તપસ્યા પ્રારંભ
- ૯. જુદા જુદા ૮ ભગ.ના રચવનથી મોક્ષ સુધીના જુદા જુદા કલ્યાણક.
- ૧૦. પોષદસમ
- ગણધર શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાન
- નંદીવર્ધન ભાઈની બેન સુર્દર્શનાએ ભક્તિ કરી.
- વર્ષીતપના પારણા.
- ક્ષમાપનાનું પવિત્ર પર્વ.
- જ્ઞાન આરાધનાનો દિવસ.
- ચ્યવન કલ્યાણક.
- આસો ચૈત્ર માસમાં.
- ભ. ઋષભદેવ જન્મ/દીક્ષા કલ્યાણક.
- ભગવાન પાર્શ્વનાથ સ્વામી જન્મ કલ્યાણક.

૧૧. મૌન અભ્યારસ	- ૧૫૦ કલ્યાણક, સંઘ સ્થાપના દિવસ.
૧૨. પર્યુષણા	- પ્રારંભનો દિવસ.
૧૩. મેરુતેરસ ભ. ગ્રઘભદેવ નિર્વાણ. સિદ્ધગિરી - હ ગાઉ યાત્રા પ્રારંભ.	
૧૪. ચોમાસી ચઉદસ	- ચાર મહિનાની આરાધનાનો દિવસ.
૧૫. પૂનમ	- શાશ્વતગિરીની યાત્રાનો મેળાનો પવિત્ર દિવસ.
૩૦. અમાસ	- ભ. મહાવીર સ્વામી નિર્વાણ કલ્યાણક.

શરીરના અંગો-અવથવો : (ક અક્ષરના સહારે) :

કપાળ, કર, કભર, કટીમેખ, કરોડરજજુ, કનિષ્ઠા, કાયા, કાન, કાકડા, કાળજુ, કીકી, કીડની, કુખ, કુલ્લા, કેશ, કેશવાહીની, કેડ, કોણી, કંઠ, કાંદુ, કાંધ.

પાંચ પ્રતિકમજાના સૂત્રો સંબંધિત પ્રશ્નમાળા :

પ્ર.૧ કયા સૂત્રની રચના એકથી વધુ વ્યક્તિઓએ (શાસનદેવી) કરી છે ?

ઉત્તર સંસાર દાવા.

પ્ર.૨ ક્યાં સૂત્રમાં બે ભાષાનો ઉપયોગ કરાયો છે ?

ઉત્તર ૧. સંસાર દાવા, ૨. સામાઈય વયજુતો. ૩. અતિચાર, ૪. સાગર ચંદો, ૫. ઈચ્છકાર.

પ્ર.૩ કયા સૂત્રના ગ્રાણ જુદા જુદા નામો છે ?

ઉત્તર ૧. નવકાર મહામંત્ર, ૨. વંદિતુસુત્ર.

પ્ર.૪ કયા કયા સૂત્રના બજે નામો છે ?

- | | |
|------------------------------------|---------------------------------------|
| ઉત્તર ૧. લોગરસ-નામસ્તવ. | ૨. નમુંણં- શક્સ્તવ. |
| ૩. જ્યવિયરાય-પ્રાર્થનાસૂત્ર | ૪. ઈચ્છામિભમા-પંચાંગ પ્રણિપાતસૂત્ર. |
| ૫. પંચિંદિય-સ્થાપના સૂત્ર. | ૬. સિદ્ધાંણ બુદ્ધાંણ-સિદ્ધસ્તવ. |
| ૭. અરિહંત ચેઈયાંણ-ચૈત્ય સ્તવ. | ૮. પુફ્ફર વરદી-શ્રુતસ્તવ. |
| ૯. સાગર ચંદો-પૌષ્ઠ પારવાનું સૂત્ર. | ૧૦. નમોડહૃત-પંચ પરમેષ્ઠી સૂત્ર. |
| ૧૧. અદ્ભાઈ જજેસુ-મુનિવંદન સૂત્ર. | ૧૨. ઈચ્છકાર-સુગુરુ સુખશાતા પૂઞ્છા. |
| ૧૩. કરેભિ ભંતે-પ્રતિજ્ઞાસૂત્ર. | ૧૪. નાણમિ-અતિચાર. |
| ૧૫. સામાઈય-સામાચિક પારવાનું સૂત્ર. | ૧૬. ઈરિયાવહિયં-લઘુપતિકમણ. |
| ૧૭. જગચિતામણિ-ચૈત્ય વંદનસૂત્ર. | ૧૮. સકલ તીર્થ-તીર્થવંદના. |
| ૧૮. અભુહીઓ-ગુરુ ખામજા સૂત્ર. | ૨૦. વાંદણા-ગુરુ વંદના સૂત્ર. |
| ૨૧. સંસાર દાવા - વીરસ્તુતિ. | ૨૨. તસ્સઉતરી - વિશેષ શુદ્ધિકરણ સૂત્ર. |
| ૨૩. અશ્વત્થ-આગાર સૂત્ર. | |

- પ્ર.૫ ક્યું સૂત્ર બોલતા બે મુદ્રાનો ઉપયોગ થાય છે ?
 ઉત્તર ૧. જ્યવિયરાય. ૨. વંદિતુ. ૩. વાંદણા.
- પ્ર.૬ ક્યા સૂત્રની માત્ર ૧-૧ ગાથામાં રચના છે ?
 ઉત્તર ૧. કમલ દલ, ૨. યસ્યા ક્ષેત્રં, ૩. જંકિંચી ૪. જાવંતિ, ૫. જાવંત, ૬. ઈચ્છામિ ખમાસમણો, ૭. વૈયાવચ્ચ, ૮. જ્ઞાનાદી, ૯. ઈચ્છાકાર, ૧૦. સવ્વસવી, ૧૧. સુઅદેવયા, ૧૨. જ્ઞસેભિતે, ૧૩. નમોડહૃત્ત.
- પ્ર.૭ ક્યા બે સૂત્રના વિચારો એક સરખા છે ?
 ઉત્તર ૧. વંદિતુ-અતિચાર. ૨. લધુશાંતિ-મોટી શાંતિ, ૩. નવકાર-નમોડહૃત્ત,
 ૪. જંકિંચ-જાવંત, ૫. ચાર ગાથાની ગણે યોગ.
- પ્ર.૮ માત્ર ગુજરાતી ભાષામાં ક્યા સૂત્ર છે ?
 ઉત્તર ૧. અતિચાર, ૨. સકલતીર્થ, ૩. સાત લાખ, ૪. ૧૮ પાપ સ્થાનક.
- પ્ર.૯ ક્યા સૂત્રથી અઢી દ્વીપના સાધુઓને વંદના થાય છે ?
 ઉત્તર ૧. અણ્ણાઈજજેસુ, ૨. સકલતીર્થ, ૩. જાવંતકેવિ, ૪. નમો લોઅએવ્સાહૂણં
- પ્ર.૧૦ ક્યા સૂત્રથી ત્રણ લોકના તીર્થ-બિબને નમસ્કાર થાય ?
 ઉત્તર ૧. જંકિંચી, ૨. સકલતીર્થ, ૩. જગચિંતામણી, ૪. જાવંત ચેઈઅઠ.
- પ્ર.૧૧ ક્યા સૂત્રો બેનો ભણી (બોલી) શકતા નથી ?
 ઉત્તર ૧. વરકનક. ૨. વિશાલલોચન. ૩. નમોડહૃત્ત ૪. સુઅદેવયા. ૫. નમોડસ્તુ. ૬. જ્ઞસેભિતે.
- પ્ર.૧૨ ક્યા સૂત્રો પુરુષોને બોલવાની ના પાડી છે ?
 ઉત્તર કમલદલ.
૧૩. ક્યા સૂત્રોનું કાઉસ્સગમાં સ્મરણ થાય છે ?
 ઉત્તર ૧. નવકાર, ૨. લોગસ્સ, ૩. નાણંમિ.
૧૪. ક્યા સૂત્રોને કાઉસ્સગમાં શાંતિથી સાંભળવાના હોય છે ?
 ઉત્તર ૧. ચાર થોયના જોડા. ૨. નાની શાંતિ, ૩. મોટી શાંતિ, ૪. કમલદલ, ૫. યસ્યા ક્ષેત્રં,
 ૬. જ્ઞાનાદિ ગુણા, ૭. જ્ઞસેભિતે, ૮. સર્વેયક્ષા, ૯. સુઅદેવયા. ૧૦. પડ્ખી સૂત્ર (શ્રાવકો માટે)
- પ્ર.૧૫ કાઉસ્સગમાં સૂત્રના સ્મરણના બદલે ક્યા વિષયનું ચિંતવન થાય છે ?
 ઉત્તર તપચિંતનની ભાવના રાઈ પ્રતિકમણ વખતે કરાય છે.
- પ્ર.૧૬ ક્યા સૂત્રમાં ૨૪ તીર્થકર ભગવાનનાં નામો આવે છે ?
 ઉત્તર ૧. લોગસ્સ, ૨. સકલાડહૃત, ૩. મોટી શાંતિ.
- પ્ર.૧૭ ક્યા સૂત્રોમાં ૫ તીર્થકર ભગવાનના નામો આવે છે ?
 ઉત્તર ૧. કલ્લાણકંદ, ૨. જગચિંતામણિ.

પ્ર.૧૮ ક્યા સૂત્રોમાં ર તીર્થકર ભગવાનના નામો આવે છે ?

ઉત્તર ૧. સિદ્ધાંશું બુદ્ધાંશું, ૨. અજિત શાંતિ.

પ્ર.૧૯ ક્યા સૂત્રોમાં માત્ર ૧ તીર્થકર ભગવાનનું નામ આવે છે ?

ઉત્તર ૧. ભક્તામર, ૨. ઉવસર્ગહરં, ૩. સંસારદાવા, ૪. નાની શાંતિ, ૫. ચર્ટક સાય. ૬. સંતિકરં, ૭. સ્નાતસ્યા.

પ્ર.૨૦ ક્યા સૂત્રમાં શાશ્વતી પ્રતિમાની સંખ્યા (તથા નામ) આવે છે ?

ઉત્તર ૧. સકલતીર્થ, ૨. જગચિતામણી.

પ્ર.૨૧ ક્યા સૂત્રમાં ૧૭૦ ભગવાનની (૫ રંગની પરિવારની) વાત આવે છે ?

ઉત્તર ૧. વરકનક, ૨. જગચિતામણી.

પ્ર.૨૨ ક્યા સૂત્રમાં ૨૦ વિહરમાન ભગવાનની કેવળી તથા સાધુની સંખ્યા આવે છે ?

ઉત્તર ૧. જગચિતામણી.

પ્ર.૨૩ ક્યા સૂત્રનો ઉપયોગ ‘સજ્જાય’ તરીકે થાય છે ?

ઉત્તર ૧. સંસારદાવા, ૨. ભરહેસર, ૩. ઉવસર્ગહરં, ૪. નવકાર, ૫. મન્જુહજ્જાણાં.

પ્ર.૨૪ ક્યા સૂત્રનો ઉપયોગ ‘સ્તવન’ તરીકે થાય છે ?

ઉત્તર ૧. ઉવસર્ગહરં, ૨. અજીતશાંતિ, ૩. સંતિકર.

પ્ર.૨૫ ક્યા સૂત્રનો ઉપયોગ ‘માંગલિક’ કાર્યોમાં થાય છે ?

ઉત્તર ૧. નવકાર, ૨. ઉવસર્ગહરં, ૩. મોટી શાંતિ, ૪. નાની શાંતિ.

પ્ર.૨૬ ક્યા સૂત્રનો ઉપયોગ માત્ર ‘એકજ’ પ્રતિકમણમાં થાય ?

ઉત્તર ૧. સકલતીર્થ, ૨. ભરહેસર, ૩. જગચિતામણી, ૪. નાની શાંતિ.

પ્ર.૨૭ ક્યા સૂત્રનો ઉપયોગ ‘ત્રાણ’ પ્રતિકમણમાં થાય છે ?

ઉત્તર ૧. અતિથાર, ૨. મોટી શાંતિ, ૩. સકલાર્ડહત, ૪. અજીતશાંતિ, ૫. પક્ખી સૂત્ર, ૬. સ્નાતસ્યા સ્તુતિ.

પ્ર.૨૮ ક્યા સૂત્ર માત્ર ‘ગુરુ’ સંબંધી ઉપયોગી થાય ?

ઉત્તર ૧. ઈચ્છાકાર, ૨. અભુક્તીઓ, ૩. જાવંતકવિ, ૪. અહાર્દ્જજેસુ, ૫. પંચિદિય, ૬. વાંદશા, ૭. ઈચ્છામિખમા, ૮. આયરિય ઉવ., ૯. ભુવનદેવતા સ્તુતિ, ૧૦. ક્ષેત્ર દેવતા સ્તુતિ.

પ્ર.૨૯ ક્યા સૂત્ર બધા મોટા અવાજે સાથે મળીને બોલે છે ?

ઉત્તર ૧. સંસાર દાવા, ૨. આમુલાલો લઘૂલી, ૩. સુઅદેવયા, ૪. ખમાસમણ, ૫. નમોડસ્તુવર્ધ, ૬. વરકનક, ૭. નમોડહત, ૮. ભગવાનડહ.

પ્ર.૩૦ ક્યા સૂત્રમાં અનેક મહાપુરુષોના નામો છે ?

ઉત્તર ૧. ભરહેસર.

પ્ર.૩૧ વર્ષમાં ‘દેવસી રાઈ’ પ્રતિકમણ કેટલા કરાય છે ?

ઉત્તર દેવસી-૩૩૫-(૩૬૦) રાઈ-૩૬૦.

પ્ર.૩૨ વર્ષમાં ‘માંગલિક’ પ્રતિકમણ કેટલા કરાય છે ?

ઉત્તર ૨૫.

પ્ર.૩૩ વર્ષમાં પદ્ભી ચાનુમારી-સંવત્સરી કેટલા કરાય છે ?

ઉત્તર પદ્ભી - ૨૧. ચાનુમારી - ૩. સંવત્સરી - ૧.

પ્ર.૩૪ મોટા સૂત્ર આવડતા ન હોય તો તેના સ્થાને બીજા સૂત્ર બોલાય ?

ઉત્તર ૧. અતિચાર - વંદિતુ, ૨. વંદિતુ - ૫૦ નવકાર, ૩. નાણાંભિ - ૮ નવકાર, ૪. લોગરસ્ - ૪ નવકાર, ૫. પદ્ભીસૂત્ર - વંદિતુ (શ્રાવકના માટે), ૬. તપચિંતન - ૧૬ નવકાર.

પ્ર.૩૫ ક્યા સૂત્રોમાં ‘૧૨ આગારો’નું વર્ણન આવે છે ?

ઉત્તર અનન્ય.

પ્ર.૩૬ ક્યા સૂત્રથી ‘૧૩ માંગણી’ ભ. પાસે થાય છે ?

ઉત્તર જ્યવીયરાય સૂત્ર.

પ્ર.૩૭ ક્યા સૂત્રમાં ૧૨ પ્રતોનો અવિકાર સંક્ષિમ-વિસ્તૃતમાં આવે છે ?

ઉત્તર ૧. અતિચાર, ૨. વંદિતુ (સંક્ષિમમાં)

પ્ર.૩૮ ક્યા સૂત્રમાં ૧૬ વિદ્યાદેવીના નામો આવે છે ?

ઉત્તર ૧. સંતિકરં, ૨. મોટી શાંતિ.

પ્ર.૩૯ ક્યા સૂત્રમાં ૧૮ પાપસ્થાનકના નામો આવે છે ?

ઉત્તર ૧. અદાર પાપસ્થાનક, ૨. અતિચાર, ૩. સંથારાપોરિસિ.

પ્ર.૪૦ ક્યા સૂત્રમાં ૧૮ પ્રકારની વિરાધનાની ક્ષમા મંગાય છે ?

ઉત્તર ૧. ઈચ્છામિઠાભિ.

પ્ર.૪૧ ક્યા સૂત્રમાં સાધુના ત૬ ગુણની ટૂંક વિચારણા છે ?

ઉત્તર પંચિદિય.

પ્ર.૪૨ ક્યા સૂત્રમાં ૫. (૩૬) આચારની વિગત આવે છે ?

ઉત્તર નાણાંભિસૂત્ર.

પ્ર.૪૩ ક્યા સૂત્રમાં ૨૪ તીર્થ. ના યક્ષયક્ષીણીના નામો છે ?

ઉત્તર સંતિકરં.

પ્ર.૪૪ ક્યા સૂત્રમાં તીર્થ. ના યક્ષયક્ષીણીના નામો છે ?

ઉત્તર નમુત્થુણાં (શક્સતવ).

પ્ર.૪૫ ક્યા સૂત્રથી ૬ (૮) કોટી (પદ્ધતિ)ના પચ્ચકખાણ થાય ?

- ઉત્તર ૧. કરેમિભંતે, ૨. પોસહ સૂત્ર, ૩. દીક્ષા અવસરે સાધુ મ. ઈકોટીના પચ્ચકખાણ (પ્રતિજ્ઞા) લે.
- પ્ર.૪૬ ક્યા સૂત્રથી ૮ (૪) પહોર સુધીના વિરતીના પચ્ચ થાય ?
- ઉત્તર કરેમિ ભંતે પોસહં
- પ્ર.૪૭ ક્યા સૂત્રમાં ૧૮, ૨૪, ૧૨૦ ભાંગાની સંક્ષિમ વાત છે ?
- ઉત્તર ઈરિયાવહીયં.
- પ્ર.૪૮ ક્યા સૂત્રથી ૧૮ હજાર શીલાંગના ધારક મુનિને વંદના થાય ?
- ઉત્તર ૧. અહાઈજ્જે, ૨. સકલતીર્થ.
- પ્ર.૪૯ ક્યા સૂત્રમાં ૮૪ લાખ જીવયોનીની વિચારણા છે ?
- ઉત્તર સાત લાખ.
- પ્ર.૫૦ ક્યા સૂત્રમાં ૪ મંગલ, લોકમાં ઉત્તમ, શરણદુપના નામો છે ?
- ઉત્તર સંથાર પોરિસી.
- પ્ર.૫૧ ક્યા સૂત્રને ‘શાશ્વતુ સૂત્ર’ કહેવાય (કહી શકાય) છે ?
- ઉત્તર ૧. નવકાર, ૨. નમુલ્યાં, ૩. કરેમિ ભંતે
- પ્ર.૫૨ ક્યા સૂત્રની રચના કરવાથી ગુરુએ શિષ્યને પ્રાયશ્ચિત આપ્યું ?
- ઉત્તર નમોડહૃત સૂત્ર.
- પ્ર.૫૩ ક્યા સૂત્રની રચના રાજા (સંઘ)ની વિનંતીના કારણે થઈ ?
- ઉત્તર ૧. ઉવસળગહર, ૨. નાની શાંતિ, ૩. ભક્તામર.
- પ્ર.૫૪ ક્યા સૂત્રમાં એકપણ જોડાકાર આવતું નથી ?
- ઉત્તર ૧. સંસાર દાવા, ૨. અજીત શાંતિ-ગાથા ૩૭.
- પ્ર.૫૫ ક્યા સૂત્રની એક ગાથામાં જી ‘લ’ની બારાખડીના ૧૫ અક્ષરો છે ?
- ઉત્તર સંસાર દાવા-ગાથા ૪.
- પ્ર.૫૬ ક્યા સૂત્રની એક ગાથામાં ‘કુરુ કુરુ’ શબ્દ ૫ વખત આવે છે ?
- ઉત્તર ૧. નાની શાંતિ ગાથા - ૧૩. ૨. અથ રક્ષ રક્ષ.
- પ્ર.૫૭ ક્યા સૂત્રની એક ગાથામાં ૧૪ ભગવતી ગુણવતી.
- ઉત્તર નાની શાંતિ. ગાથા ૧૪ ભગવતી ગુણવતી.
- પ્ર.૫૮ ક્યા સૂત્રની રચના અનેક રાગમાં કરવામાં આવી છે ?
- ઉત્તર ૧. અજીત શાંતિ, ૨. સંસાર દાવા સ્તૃતિ, ૩. સ્નાતસ્યા સ્તૃતિ.
- પ્ર.૫૯ ક્યા સૂત્રનું સ્મરણ ઈન્જ મહારાજા ઈન્દ્ર સભામાં યોગમુદ્રામાં કરે છે ?
- ઉત્તર ૧. નમુલ્યાંસૂત્ર.
- પ્ર.૬૦ ક્યા સૂત્રનો ઉપયોગ ‘નવકાર વાળી’ ગણતાં થાય છે ?

- ઉત્તર ૧. નવકાર, ૨. લોગસ્સ, ૩. કાઉસર્જન.
- પ્ર.૬૧ ક્યા સૂત્રમાં શ્રાવકના ઉદ્દેશ્યાનું બતાડ્યા છે ?
- ઉત્તર મન્હળજાણાણ.
- પ્ર.૬૨ ક્યા સૂત્રનો સંપૂર્ણ ઉપયોગ કિયામાં ખાસ થાય છે ?
- ઉત્તર ૧. જ્ય વિષરાય, ૨. લોગસ્સ (કાઉસર્જનમાં)
- પ્ર.૬૩ ક્યા સૂત્રનો ઉપયોગ પ્રતિકમણમાં થોડા અંતરે ચાર વિભાગમાં થાય છે ?
- ઉત્તર ૧. કલ્લાણાર્કદં, ૨. સંસારદાવા, ૩. સ્નાતસ્યા, ૪. ભગવાનહં.
- પ્ર.૬૪ ક્યા સૂત્રથી ફીઝાવંદન, થોભવંદન, દ્વાદ્શાવર્તવંદન થાય ?
- ઉત્તર ૧. ઈચ્છામિ ખમાસમણો, ૨. ઈચ્છાકાર, ૩. અભમુહિઓ.
- પ્ર.૬૫ પાંચ પ્રતિ.માં નાનામાં નાનું સૂત અને મોટામાં મોટું સૂત ક્યું ?
- ઉત્તર નાનું સૂત - ૧. ભગવાનહં, ૨. નમોહર્ત.
- મોટું સૂત - ૧ અતિચાર. ૨. (પદ્ધાસૂત)
- પ્ર.૬૬ પાંચ પ્રતિ.ની કિયામાં ઓછામાં ઓછો અને વધુમાં વધુ કાઉસર્જ કેટલા શાસોશાસનો હોઈ શકે ?
- ઉત્તર ૧. ઓછામાં ઓછા ૮ શાસોશાસ પાંચે પ્રતિકમણમાં.
૨. વધુમાં વધુ ૧૦૦૮ શાસોશાસ સંવત્સરી પ્રતિકમણમાં.
- પ્ર.૬૭ કઈ મુદ્રામાં ક્યા સૂત્રો બોલાય છે ?
- ઉત્તર ★ પંચિદિય સૂત્ર - સ્થાપના મુદ્રા.
★ ખમાસમણાં - પંચાંગ પ્રણિપાત.
★ ચૈત્યવંદન, નમુદ્યુણાં, સક્લાર્હત્ = યોગમુદ્રા.
★ જ્યવીચરાય, આયરિય, જાવંત, જાવંતિ = મુક્તાસુક્લિત.
★ લોગસ્સ, નાણમ્ભી, નવકાર = કાઉસર્જ મુદ્રા.
★ નવકાર-સ્થાપન-ઉત્થાપન વિગેરે અનેક મુદ્રા.
★ વાંદણા - યથાજીત મુદ્રા.
★ પ્રતિકમણ ઠાવવાનું - યમુર મુદ્રા.
★ વંદિતુ - વીરાસન મુદ્રા. (ધનુષ્ય મુદ્રા)
★ અરિહંત ચેઈ = જિનમુદ્રા.
- પ્ર.૬૮ ઇ આવશ્યક ખાસ ઉપયોગી થાય તેવા ૧-૧ સૂત્ર બતાડો ?
- ઉત્તર ૧. સામાયિક - કરેમિભંતે, ૨. ચારુવિસત્થો - ચૈત્યવંદન, ૩. વંદન - વાંદણા, ૪. પ્રતિકમણ - ઈચ્છામિ
- ઠામિ. વંદિતુ, ૫. કાઉસર્જ. - સુખદેવયા કરેમિ. જ્ઞા.દ.ચા. આચારના.

૬. પદ્ધત્કખાણ- પદ્ધત્કખાણ (નવકારશી ચંદ્રવિહાર વિગેરે)

પ્ર.૬૯ જે સૂત્રમાં જ્ઞાનના ઉપકરણના અને આચારના નામ છે તે લખો ?

ઉત્તર ૧. અતિચાર, ૨. નાણંમિ.

પ્ર.૭૦ ક્યા સૂત્રથી શુતજ્ઞાનને વંદન, શુત દેવીનું સ્મરણ થાય છે ?

ઉત્તર ૧. પુરુષરવર, ૨. કમલદલ, ૩. સુખદેવયા, ૪. વૈયાવચ્ચગરાણ.

પ્ર.૭૧ ક્યા સૂત્રના નામને છેલ્લે ‘સ્તવ’ શબ્દ આવે છે ?

ઉત્તર ૧. નામસ્તવ, ૨. શક્તસ્તવ, ૩. શુતસ્તવ, ૪. સિદ્ધસ્તવ, ૫. ચૈત્યસ્તવ.

પ્ર.૭૨ ક્યા સૂત્રથી સિદ્ધ ભગવંતોની સ્તુતિ થાય છે ?

ઉત્તર સિદ્ધાણં બુદ્ધાણં.

પ્ર.૭૩ ક્યા સૂત્રથી ક્ષેત્ર દેવતાને યાદ કરાય છે ?

ઉત્તર ૧. યસ્યા ક્ષેત્ર, ૨. જ્ઞસેભિતે.

પ્ર.૭૪ ક્યા સૂત્રને બોલતા (વિધિ કરતા) મુનિ કેવળી થયા ?

ઉત્તર ઈરિયવહિયં સૂત્ર.

પ્ર.૭૫ ક્યા સૂત્રમાં હાથી, સિંહ, કમળ, દિપક સાથે ભગવાનની સરખામણી કરાય છે ?

ઉત્તર નમુખ્યુણં.

પ્ર.૭૬ ક્યા પ્રતને સ્વીકારવાથી શ્રાવધ સાધુ જેવો બને ?

ઉત્તર ૧. પૌષ્ઠ, ૨. સામાયિક.

પ્ર.૭૭ ક્યા કારણ (કિયા)થી ગ્રાણ નરકના દલિયા ઓછા થયા ?

ઉત્તર ૧૮,૦૦૦ સાધુને ભાવથી વંદના કરવાથી.

પ્ર.૭૮ ક્યું સૂત્ર કળણ કરતાં બોલવામાં આવે છે ?

ઉત્તર ૧. મોટી શાંતિ, ૨. નવકાર, ૩. ઉવસર્ગાહરં.

પ્ર.૭૯ ક્યા સૂત્રથી ર/લીટી બોલતાં (વિધિ વખતે) માથા પર પાણીના છાંટણા કરાય છે ?

ઉત્તર મોટી શાંતિ.

પ્ર.૮૦ ક્યા સૂત્રોના પાઠો સાધુ મહારાજ પ્રતિકમણમાં સુધારીને બોલે છે ?

ઉત્તર ૧. કરેમિ ભંતે, ૨. ઈચ્છામિ ધામિ.

પ્ર.૮૧ ક્યા સૂત્રોના પાઠો સમય જોઈને સુધારી બોલાય છે ?

ઉત્તર ૧. ઈચ્છકાર, ૨. અભ્યુદ્ધિઓ, ૩. વંદિતુ, ૪. અતિચાર, ૫. વાંદણા,
૬. ઈચ્છામિધામિ, ૭. પ્રતિકમણ ધાઉ?

પ્ર.૮૨ ‘જંકિયી’ શબ્દથી શરૂ થતાં પદો લખો ?

ઉત્તર ૧. જંકિયિ નામ તિત્થં, ૨. જંકિયિ આપત્તિઅં, ૩. જંકિયિ મજજવિષાય.

પ્ર.૮૩ ‘નમો’ શબ્દથી શરૂ થતાં પદો લખો ?

ઉત્તર ૧. નમો અરિહંતાણં, ૨. નમો સિદ્ધાણં, ૩. નમો આયરિયાણં, ૪. નમો ઉવજાયણં, ૫. નમો લોએ સવ્યસાહૂણં, ૬. નમો જ્ઞાણાણં, ૭. નમોડહૃત, ૮. નમો સયા સવ્ય. ૯. નમોડસુ, ૧૦. નમો નમ: શાન્તિનાથાય. ૧૧. નમો નમો ડીં ડીં. ૧૨. નમો નમો ભગવતેડહૃતે, ૧૩. નમો નમ: શાંતયે તસ્મૈ, ૧૪. નમો ખમાસમણાણં.

પ્ર.૮૪ ‘ઈ’ શબ્દથી શરૂ થતા સૂત્રના નામો લખો ?

ઉત્તર ૧. ઈચ્છામિ, ૨. ઈચ્છાકાર, ૩. ઈચ્છાકારેણ સંદિસહભગ. ઈરિયા. ૪. ઈચ્છાકારેણ સં.ભ. અભ્યुહિઓ.

૫. ઈ.સં.ભ. ચૈત્યવંદન, ૬. ઈચ્છામિ ઠામી.

પ્ર.૮૫ ઉપધાનમાં ક્યા સૂત્રની તપ-સહિત વાચના અનુજ્ઞા લેવાય ?

ઉત્તર ૧. નવકાર, ૨. લોગસ્સ, ૩. પુઝખરવર, ૪. નમુથ્યણં, ૫. સિદ્ધાણં, ૬. ઈરિયાવહિયં, ૭. તસ્સઉત્તરી ૮. અસ્ત્થ, ૯. અરિહંત ચેઉઆણં.

પ્ર.૮૬ કાઉસગ પૂર્ણ થયો તે બીજાને ખબર કેમ પડે ?

ઉત્તર નમો અરિહંતાણં મોટેથી બોલવાથી.

પ્ર.૮૭ ક્યા પ્રતિ.ના એક જ કાઉ.માં ક્યા બે સૂત્રનું સ્મરણ થાય છે ?

ઉત્તર સંવત્સરીના પ્રતિ.માં ૪૦ લોગસ્સ અને ૧ નવકાર બોલાય છે.

પ્ર.૮૮ કાઉસગમાં ક્યારે સૂત્ર સંપૂર્ણ, અપૂર્ણ અને થોડું ઓદ્ધું સ્મરણ કરવાનું હોય છે ?

ઉત્તર ૧. સંપૂર્ણ-શાંતિના કાઉમાં, ૨. અપૂર્ણ-સાગરવર ગંભીરા - કુસુમિણ સ્વમ
૩. ઓદ્ધું (અપૂર્ણ) - ચંદેસુ નિભ્મલયા - વિધિના કાઉસગમાં.

પ્ર.૮૯ ક્યા પ્રતિ.માં પચ્યકખાણ આવશ્યકની મુહુપત્તિનું બે વખત પડિલેહણ થાય છે ?

ઉત્તર ૧. પદ્ધભી, ૨. ચઉમાસી, ૩. સંવત્સરી, ૪. દેવસી.

પ્ર.૯૦ માત્ર મુહુપત્તિનું પડિલેહણ કરી ક્યા પ્રતિકમણનો પ્રારંભ થાય ?

ઉત્તર ૧. પદ્ધભી, ૨. ચોમાસી, ૩. સંવત્સરી.

પ્ર.૯૧ પ્રતિ.માં ચાલુ કિયા (સૂત્ર) ફરી ક્યા કારણે કરવી પડે ?

ઉત્તર ૧. છીક આવવાથી, ૨. આડ પડવાથી.

પ્ર.૯૨ વર્ષમાં કયાં દ સણંગ દિવસોમાં પાંચમાંથી ક્યા ચાર (પાંચ) પ્રતિકમણ સંઘ કરે છે ?

ઉત્તર દિવસ-શ્રાવણ વદિ ૧૪ થી. ભાદરવા સુદ-૪ પ્રતિકમણ-ચોમાસી પ્રતિકમણ છોડી- બાકીના-૪ રૂ
માંગલિક.

પ્ર.૯૩ સાધુ-સાધ્વીજ માંગલિક પ્રતિ. ક્યારે કરે ?

ઉત્તર ૧. પદ્ધભી-ચોમાસી-સંવત્સરીના આગલા દિવસે. ૨. વિહાર કરેલો હોય તે દિવસે.

પ્ર.૮૪ સાધુ-સાધી હોવા છતાં માત્ર શ્રાવકો જ પ્રતિકમણમાં કઈ કિયા કર્યું સૂત્ર બોલી કરે ?

ઉત્તર ૧. સામાયિક લેવા પારવાની વિધિ. ૨. અહૃતીજજેસુ સૂત્ર દ્વારા વંદનાની કિયા.

પ્ર.૮૫ પાંચ પ્રતિ.માં આવતા થોયના-૩ જોડા કયા બે પ્રતિ.માં માત્ર ૧૨ કલાકમાં બોલાય ?

ઉત્તર થોય-૧, કલ્લાણકંદ, ૨. સંસારદાવા, ૩. સ્નાતસ્યા. પ્રતિકમણ-રાઈ, ૨.પદ્ધભી-ચઉમાસી-સંવત્સરી.

પ્ર.૮૬ કયા બબ્બે સૂત્રનું છેલ્લું પદ એક છે, પણ અર્થ - પ્રવૃત્તિ જુદી છે ?

ઉત્તર ૧. સૂત્ર - અભ્યુહિકો	પદ - તસ્સમિચ્છામિદુક્કડં પ્રવૃત્તિ	- ક્ષમાપના
૨. સૂત્ર - ઈરિયાવહિયં	પદ - તસ્સમિચ્છામિદુક્કડં પ્રવૃત્તિ	- પાપની આલોચના
૩. સૂત્ર - ઈચ્છામિદામિ	પદ - તસ્સમિચ્છામિદુક્કડં પ્રવૃત્તિ	- પાપની આલોચના
૪. સૂત્ર - સવ્વસવિ	પદ - તસ્સમિચ્છામિદુક્કડં પ્રવૃત્તિ	- પાપની આલોચના
૫. સૂત્ર - કરેમિભંતે	પદ - અપ્પાણં વોસિરામિ પ્રવૃત્તિ	- પ્રતિજ્ઞા ગ્રારંભ
૬. સૂત્ર - અનત્થ	પદ - અપ્પાણં વોસિરામિ પ્રવૃત્તિ	- કાઉસગ ગ્રારંભ
૭. સૂત્ર - વાંદળા	પદ - અપ્પાણં વોસિરામિ પ્રવૃત્તિ	- અવિનયની ક્ષમા

પ્ર.૮૭ કયા સૂત્રની છેલ્લી ગાથા એક સરખી છે ?

ઉત્તર ૧૧. જય વિયરાય, ૨. લઘુ શાંતિ, ૩. મોટી શાંતિ.

પ્ર.૮૮ સાધુ મ. પ્રતિકમણમાં શ્રાવકોથી જુદા કયા સૂત્રો બોલે છે ?

ઉત્તર ૧. વંદિતુ - પગમસજ્જાય, ૨. નાણાંમિ - સયણા સણન્નપાણે, ૩. સાત લાખ - ધાણેકમણે
૪. અચિતાર - પદ્ધભી અતિચાર, ૫. પદ્ધભી સૂત્ર, ૬. ખામણા (નવકાર) = ચાર ખામણાના પાઠ.

પ્ર.૮૯ કયા સૂત્રની એક ગાથામાં સંસ્કૃતની આઠ વિભક્તિનો પ્રયોગ છે ?

ઉત્તર સૂત્ર - સકલાડર્હત ગાથા - વીર સર્વ.

પ્ર.૧૦૦ થોય - સ્તવન - સૂત્ર રાગ - (ચાલ) કાઢ્યા વિના ઉતાવળે ક્યારે બોલાય ?

ઉત્તર સાધુ-સાધીના કાળ ધર્મના સમાચાર આવ્યા વિના દેવ વંદન કરતી વખતે.

પ્ર.૧૦૧ સતર બેદી પૂજાનો દડ કયા કારણે પ્રતિકમણ કરનારને થાય ?

ઉત્તર છીંક આવવાથી. (ચોમાસી - સંવત્સરી આદિ પ્રતિકમણમાં)

પ્ર.૧૦૨ રાત્રી પોખાતી પ્રતિકમણ પૂર્વે ખાસ કઈ કિયા કરે છે ?

ઉત્તર માંડલા, (ચારે દિશામાં જવાની મર્યાદા બાંધવા).

પ્ર.૧૦૩ પ્રતિકમણમાં પોખાતી જરૂરી શબ્દ અથવા સૂત્ર કયા સુધારીને બોલે ?

ઉત્તર સૂત્ર ૧. કરેમિ ભંતે શબ્દ જાવ પોસહં.

૨. સાત લાખ, અઢાર પાપના બદલે ગમણા ગમણે.

પ્ર.૧૦૪ રાત્રી પોખાતી પ્રતિકમણ બાદ કઈ કિયા કરે છે ?

- ઉત્તર સંથારા પોરિસિ, ભાણાવવાની.
- પ્ર. ૧૦૫ પાંચ પ્રતિકમણાના સૂત્ર દ્વારા કઈ કઈ ધાર્મિક કિયાઓ થાય ?
- | | | | |
|-------|-----------------------|----------------------|--------------------|
| ઉત્તર | ૧. સામાયિક લેવાનું | ૨. રાત્રી પ્રતિકમણ | ૩. ચૈત્યવંદન |
| | ૪. દેવવંદન | ૫. ગુરુ વંદન | ૬. પૌષ્ઠ્ર |
| | ૭. દેવસી પ્રતિકમણ | ૮. ચોમાસી પ્રતિકમણ | ૯. પદ્મખી પ્રતિકમણ |
| | ૧૦. સંવત્સરી પ્રતિકમણ | ૧૧. સંથારા પોરિસી | ૧૨. ઉપધાન |
| | ૧૩. પચ્ચકખાણ પારવાનું | ૧૪. સામાયિક પારવાનું | ૧૫. પરીલેહણ |
| | ૧૬. દ્વાદ્શાવર્ત | ૧૭. રાઈમુહુપત્તિ | ૧૮. માંડલા |
| | ૧૮. ગમણા ગમણો | ૨૦. સજ્જાય | ૨૧. શાંતિકળશ |
- પ્ર. ૧૦૬ કોઈપણ ૧૦ સૂત્ર અને તેના રચયિતાના નામ આપો ?
- | | | |
|-------|-------------------------|-------------------------------|
| ઉત્તર | ૧. જગ ચિંતામણિ | - શ્રી ગૌતમ સ્વામીજી |
| | ૨. સકલાઉહૃત્ | - શ્રી હેમચંદ્રાચાર્યજી |
| | ૩. ભક્તામણ, નામિઉણ | - શ્રી માનતુંગસૂરિજી |
| | ૪. ઉવસંહરં | - શ્રી ભદ્રબાહુસૂરિજી |
| | ૫. નમોઉહૃત/કલ્યાણ મંદિર | - શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી |
| | ૬. લઘુશાંતિ | - શ્રી માનદેવસૂરિજી |
| | ૭. સંસાર દાવા | - શ્રી હરિભદ્રસૂરિજી |
| | ૮. સકલ તીર્થ | - શ્રી જવવિજયજી |
| | ૯. અજીતશાંતિ | - શ્રી નંદીપેણામુનિ |
| | ૧૦. સંતિકરં | - શ્રી મુનિ સુંદરસૂરિજી |
- પ્ર. ૧૦૭ ક્યા સૂત્રના ક્યા અક્ષર છોડીને, સુધારીને, સમય જોઈને બોલાય છે ?
- | | |
|-------|---|
| ઉત્તર | ૧. વાંદળા ‘આવસ્સિયાએ (બીજીવાર) ૨. ઈચ્છકાર સુહરાઈ (સુહદેવસિ) |
| | ૩. અભ્યુહ્ન દેવસિં (રાઈથ) ૪. રાઈઆદિ પ્રતિકમણાં જરૂરી સ્થળે રાઈઅં. |
- પ્ર. ૧૦૮ સાધુ અને પોસાતીને ધન્યવાદ પ્રતિકમણમાં શ્રાવકો ક્યા શાઢથી આપે ?
- | | |
|-------|--|
| ઉત્તર | સાધુ-ધન્ય મુનિરાજ (પદ્મખી અતિચારમાં તથા ઠાણક્કમણો સૂત્ર પછી)
પોસાસી - ધન્ય પોસાતી. (ગમણા ગમણો સૂત્ર બોલ્યા પછી) |
|-------|--|
- પ્ર. ૧૦૯ ક્યા સૂત્ર પંચ પ્રતિકમણની વિધિમાં બોલાતા નથી ?
- ઉત્તર પંચિદિય સંથારા પોરિસી, સાગરચંદો, સામાઈય વયમુતો, મન્દ જિણાણં.
- પ્ર. ૧૧૦ ઠાવા વગર ક્યા ક્યા પ્રતિકમણ થાય છે ?
- ઉત્તર પદ્મખી, ચામાસી, સંવત્સરી.

પ્ર.૧૧૧ ક્યા પ્રતિકમણમાં ક્યા સૂત્રનો શબ્દ (અક્ષર) સુધારી બોલાય છે ?

ઉત્તર ચંદુમાસી પ્રતિકમણમાં વાંદણા સૂત્રનો ‘વઈકંતો’ શબ્દ.

પ્ર.૧૧૨ છ આવશ્યક વિનાની મુહુપત્તિનું પડિલેહણ પ્રતિકમણમાં ક્યારે થાય ?

ઉત્તર પદ્ભી પ્રતિકમણ, ચોમાસી, સંવત્સરી, સામાયિક લેવાની, પારવાની વિધિમાં.

પ્ર.૧૧૩ પ્રતિકમણ રરરરર=હ વાંદણા એક સાથે કમશઃ ક્યારે બોલાય છે ?

ઉત્તર પદ્ભી, ચોમાસી, સંવત્સરી, પ્રતિકમણ સમાત થાય ત્યારે કમશઃ ખામણા ખામ્યા પઢી અને દેવસિ પ્રતિકમણના ખામણા વખતે બોલાય છે ?

પ્ર.૧૧૪ પંચ પ્રતિકમણમાં ક્યું સૂત્ર સાધુ/શ્રાવક થોડું સાંભળે/થોડું બોલે છે ?

ઉત્તર સંસાર દાવા, ૨. નમોડસ્તુ, ૩. અતિચાર.

પ્ર.૧૧૫ છ આવશ્યકમાં ક્યા ક્યા આવશ્યકનો પ્રારંભ ‘મુહુપત્તિ’ની પડિલહેણથી થાય છે ?

ઉત્તર ૧. સામાયિક, ૨. વંદણા, ૩. પચ્ચકખાણ.

પ્ર.૧૧૬ ૨૨ ભગવાનના સાધુ પ્રતિકમણ ક્યારે કરે ?

ઉત્તર જે સમયે દોષ લાગ્યો હોય તે સમયે.

પ્ર.૧૧૭ પ્રતિકમણમાં પૂ.સાધુ મ. ક્યા સૂત્ર શ્રાવક બોલે તો સાંભળે (આદેશ આપે)

ઉત્તર થોય, સ્તવન, સંતિકરં, અજિતશાંતિ, મોટી શાંતિ, નાની શાંતિ.

પ્ર.૧૧૮ ‘ઈચાકાર’ સૂત્ર ક્યા પ્રતિકમણમાં બોલાય છે ?

ઉત્તર રાઈ પ્રતિકમણમાં.

વનસ્પતિમાં જીવસિદ્ધિ :

- ★ શબ્દગ્રહણ શક્તિ-કંદલ, કુંડલ, વગેરે વનસ્પતિ મેઘ ગર્જનાથી, નવપલ્લવિત થાય છે.
- ★ રૂપ-વેલાઓ લતાઓ આશ્રય તરફ ફરીને વધે છે.
- ★ ગંધ - કેટલીક વનસ્પતિ ધૂપના સુગંધથી વધુ છે.
- ★ રસ - શેરડી વિ. જમીનમાંથી મીઠો રસ ચૂસે છે.
- ★ સ્પર્શ - લજજણુ વિ. વનસ્પતિ સ્પર્શથી સંકોચાઈ જાય છે.

વનસ્પતિમાં ૧૬ લાગણીના દર્શન

- ★ નિંદ્રા - પુનાલ, આંબલી, કમલ વિ. અમુક વખતે સંકોચાય ખીલે.
- ★ રાગ - અશોક, બજુલ, ફણસ વિ. ઝંકાર, ઝંઝર સહિત ખીના પગના પ્રહારથી ફળે છે.
- ★ હર્ષ - કેટલીક વનસ્પતિ અકાળે ખીલી ઉઠે છે.
- ★ લોભ - ધોળો આંકડો, ખાખરા બિલીવૃક્ષ વિ.ના મૂળ જમીન ઉપર નિધાન હોય ત્યાં ફેલાય છે.
- ★ લજજા - વેલમાં લજજણુપણું દેખાય છે.

- ★ ભય - એજ વેલમાં ભય-ડર દેખાય છે.
- ★ મૈથુન - પપૈયામાં નર-માદા હોય છે. નરનો પરાગ (સુગંધ) માદાના ફૂલમાં પડે તો જ ફળે.
- ★ કોધ - કોદનનું વૃક્ષ હુંકાર અવાજ કરે છે.
- ★ માન - રૂદ્ધતી વેલામાંથી પાણીના ટોપા જરે વે તેથી સોનાની સિદ્ધિ થાય છે.
- ★ માયા - વેલાઓ પોતાના ફળને પાંદડાથી ઢાંકે છે.
- ★ આહાર - પાણી, ખાતર વિ. મળે તો વધે છે. અન્યથા સુકાઈ જાય છે.
- ★ જન્મ - જમીનમાં વાવવાથી જ ઉગે છે, જન્મે છે.
- ★ વૃક્ષિ - અંકુર, ડાળ, પાંદડા, વૃક્ષ વિ. થાય છે.
- ★ મરણ - હિમ, અતિવૃદ્ધિ, વિ. આધાતથી મરણ થાય છે, કરમાય છે.
- ★ રોગ - હવા, પાણી, ખોરાક વિ. થી રોગ થાય ઔષધોપચાર કરવાથી મટે છે.
- ★ ઓધ - વેલા ચડવા માટે ઝાડ, વાવ તરફ વળે આશ્રય લે.

દર્શન :

ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન.

જીવના ૨૪ દ્વારા :

શરીર, અવગાહના, સંઘયણ, સંજ્ઞા, સંસ્થાન, કષાય, લેશ્યા, ઈન્દ્રિય, સમુદ્રધાત, દષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, ચ્યવન, આયુષ્ય, પર્યાપ્તિ, કિમાહાર, ગતિ, અગતિ, વેદ.

શિષ્યની માગણી :

- | | |
|--------------------------|------------------------------|
| ૧. નાંદિસૂત્ર સંભળાવોજી | ૨. મમ મુંડાવેછ |
| ૩. મમ પવ્વાવેછ | ૪. મમ વેસં સમઘેછ |
| ૫. આલાપક ઉચ્ચરાવોજી | ૬. મમ નામ ઠવણાં કરે |
| ૭. ઈ.ભ.પ. પચ્ય. આ.દેશોજી | ૮. હિતશિક્ષા પ્રસાદ કરાવોજી. |

જ્ઞાનના આચાર : ૮

- ★ કાલે = ભણવાના કાળે ભણવું, અકાળે ન ભણવું
- ★ વિનયે = વિનયપૂર્વક ભણવું.
- ★ બહુમાન = બહુમાનપૂર્વક ભણવું.
- ★ ઉપહાણે = ઉપધાનાદિ તપસહિત ભણવું.
- ★ અનિન્હવણે = ભણવનાર ગુરુને ભૂલવા નહીં.
- ★ વંજન = શુદ્ધ ઉચ્ચારપૂર્વક ભણવું.
- ★ અર્થ = અર્થ જાણીને મણવું.

★ તદુભ્ય = સૂત્ર - અર્થ બંને શુદ્ધ ભાષાવા.

શ્રાવકના કર્તવ્યો :

દૈનિક કર્તવ્યો - ૧૪ (૧૬)

- | | | |
|----------------------|------------------|-------------------|
| ★ બ્રહ્મ સમયે જાગવું | ★ રાઈ પ્રતિકમણ | ★ દેવદર્શન |
| ★ ગુરુ વંદના | ★ ગૃહ વ્યવસ્થા | ★ વ્યાખ્યાન શ્રવણ |
| ★ સ્નાન | ★ દેવપૂજા | ★ ભોજન |
| ★ સુપાત્રોદાન | ★ વ્યાપાર શુદ્ધિ | ★ સામાયિક |
| ★ દેવસિ પ્રતિકમણ | ★ સ્વાધ્યાય | ★ ધર્મચર્ચા |
| ★ વડીલોની ભક્તિ. | | |

રાત્રિ કર્તવ્ય-૮

- | | | |
|-------------------|-----------------|------------------|
| ★ ધર્મ જાગરણ | ★ સુકૃત અનુમોદન | ★ દુષ્ટુંય નિંદા |
| ★ ચાર શરણ સ્વીકાર | ★ અલ્પ નિંદ્રા | ★ સાગર અનશન |
| ★ રાત્રી ચિંતન | ★ મનોરથ સેવન | ★ રાઈ પ્રતિકમણ |

પર્વ કર્તવ્ય-૮

- ★ પૌષ્ઠ ગુરુ
- ★ ઉપવાસ
- ★ દાન
- ★ શીલ
- ★ તપ
- ★ ભાવ
- ★ અહિસા
- ★ જ્યશા
- ★ પ્રભાવના.

ચાતુર્માસિક કર્તવ્ય-૮

- | | | |
|----------------|--------------|------------------|
| ★ નિયમગ્રહણ | ★ દેસાવગાસિક | ★ સામાયિક |
| ★ અતિથિસંવિભાગ | ★ તપશ્રંય | ★ અધ્યયન |
| ★ સ્વાધ્યાય | ★ જ્યશા પાલન | ★ શાસન પ્રભાવના. |

વાર્ષિક કર્તવ્ય-૧૧

- | | | |
|-----------------|-------------------|-------------|
| ★ સંઘપૂજા, | ★ સાધર્મિક ભક્તિ | ★ યાત્રાયિક |
| ★ સ્નાતોત્સવ | ★ દેવદ્રવ્યવૃદ્ધિ | ★ મહાપૂજા |
| ★ રાત્રી જાગરણ | ★ શુતપૂજા | ★ ઉદ્ઘાટન |
| ★ શાસન પ્રભાવના | ★ આલોચના | |

જીવન કર્તવ્ય - ૧૦ રૂ ત

- | | | |
|---------------------|---------------------|--------------|
| ★ જિન મંદિર બાંધવું | ★ ગૃહમંદિર રાખવું | ★ જિનબિલ્લ |
| ભરાવવું | | |
| ★ પ્રતિષ્ઠા કરવી | ★ દીક્ષા અપાવવી | ★ આગમ લખાવવા |
| ★ પૌષ્ઠશાળા બાંધવી | ★ સિદ્ધગીરી ચોમાસું | ★ ૮૮ યાત્રા |

<p>★ છ'રીપાલીત સંઘ કરવી</p> <p>★ ઉપધાન કરાવવા.</p> <p>સમાધિમરણાના ૧૦ કર્તવ્ય :</p> <ul style="list-style-type: none"> ★ અણસણ ચાર આહાર ત્યાગ ★ બારવત ગ્રહણ <p>અનુમોદના</p> <ul style="list-style-type: none"> ★ ચાર શરણ ★ નવકાર સ્મરણ <p>પર્યૂષણાના કર્તવ્ય-૫</p> <ul style="list-style-type: none"> ★ અમારી પ્રવર્તન ★ અઙ્ગમત્પ <p>ઉત્તમ ૧૩ (૧૫) ગુણ :</p> <p>મનુષ્યપણું, ઉત્તમકુળ, સારોવૈભવ, દીર્ઘ આયુષ્ય, નિરોગી શરીર, સારો મિત્ર, સદ્બુદ્ધિ, ધર્મપરાયણ ખ્રી, પ્રભુભક્તિ, જ્ઞાન પ્રાપ્તિ, વિનધી, ઇન્દ્રિયજ્ય, દાનપ્રીતિ, વિ. વિચાર.</p> <p>શ્રાવકની પડિમા-૧૧ :</p> <ul style="list-style-type: none"> ૧. સમ્યકૃત્વ દર્શન પડિમા ૨. વ્રત પડિમા ૩. સામાયિક પડિમા ૪. પૌષ્ઠ્ર પડિમા ૫. કાયોત્સર્ગ પડિમા ૬. બ્રહ્મચર્ય પડિમા ૭. સચિતાહાર વર્જન પડિમા <p>★ પદવી અપાવવી</p> <p>★ પાયની આલોચના</p> <p>★ દુષ્કૃતનિંદા</p> <p>★ શુદ્ધ ભાવના ભાવવી.</p> <p>★ સાધ્યમિક વાત્સલ્ય</p> <p>★ ચૈત્ય પરિપાટી.</p> <p>★ પાપ વોસરાવવા</p> <p>★ સુકૃતની</p> <p>★ ક્ષમાપના</p>	<p>★ પ્રતિમા વહન</p>
--	----------------------

૮. આરંભ વર્જન પડિમા
૯. મહારંભ ત્યાગ પડિમા
૧૦. પ્રેષ્યારંભ પડિમા
૧૧. શ્રમણ ભૂત પડિમા
- પ્રથમ સાત પડિમા ઉપરાંત આઠ મહિના સુધી આરંભ સમારંભ પોતે ન કરવા (કરાવવાની છૂટ-જયણા)
 - આઠ પડિમા સહિત નવ મહિના સુધી આરંભ-સમારંભ કરવા-કરાવવા નહિ.
 - નવ પડિમા ઉપરાંત દશ મહિના સુધી પોતાના નિમિત્તે બનાવેલ ભોજન ત્યાગ. માથે મુંડન કરાવવું. સંસાર સંબંધી જવાબ હા-ના આપવામાં ઉપયોગ.
 - દશ પડિમા સાથે સ્વજન સંબંધ ત્યજી ૧૧ મહિના સુધી સાધુના જેવું જીવન ગાળવું. ભીક્ષા (ગોચરીની જેમ) લાવીને વાપરવી. શ્રમણોપાસક બનવું.

શ્રોતાના ૧૪ ગુણા :

★ વ્યાઘ્યાતા ઉપર પ્રેમ-ભક્તિ ★ નિરાભિમાની ★ સાંભળવાની રૂચિવાળા ★ ચપળતા વિનાનો ★ મુમુક્ષુ-કર્મના બંધનથી મૂકાવવાની ઈચ્છાવાળો ★ પ્રશ્ન માટે વિવેક રાખનાર ★ બહુશ્રુત (અનુભવી) ★ નિંદ્રા વિનાનો ★ અપ્રમાદી ★ નિર્મળ બુદ્ધિવાળો ★ દાનની રૂચિવાળો ★ વિકથાનો ત્યાગી ★ કૃતશ્ર ગુણા

શ્રોતાઓના પ્રકારો - ૧૪

- ★ માટી જેવા
- ★ ચારણી જેવા
- ★ પાડા જેવા
- ★ પોપટ જેવા
- ★ ઘોડા જેવા
- ★ બિલાડી જેવા
- ★ કાગડા જેવા
- ★ મચ્છર જેવા
- ★ જળો જેવા
- ★ કાણવાળા ઘડા જેવા
- શ્રવણ કરતાં માટીની જેમ નરમ, ૪ ઘડી પછી કડક.
 - ચારણી કચરો સંગ્રહે તેમ તત્ત્વજ્ઞાનને ફેંકી દેનાર.
 - પાણીમાં હોય ત્યારે શાંત, કાળાંતરે બહાર પાગલ. તેમ કથા સાંભળે ત્યારે ધર્મ દુકાન-ધરમાં અધર્મી.
 - શિખવેલું બોલે, ધર્મ જાણે નહિ. આચરે નહિ.
 - અસવારને સ્વાધીન હોય ત્યાં સુધી સખણો, છૂટો થતાં સ્વતંત્ર.
 - આંખો બંધ કરી ધ્યાન ધરે, પણ ભક્ત (ઉદ્દર) દેખતા જ બગલા ભગતની જેમ તરાપ મારે. સાંભળે પણ જીવનમાં ઉતારે નહિ.
 - નદીમાંનું પાણી ના પીએ, પણ પણીયારીના ઘડામાંથી પીએ. સમક્ષિની સાથે મિથ્યાત્વોની પણ સોબત રાખે.
 - લોહી તરસ્યા મચ્છર કાન પાસે ગાણગણાટ કરે, તેમ ધર્મકથામાં આવે પણ શાંતિ ન રાખે. ચંચળ બને.
 - બીજાનું લોહી ચૂસે પણ પચાવી ન શકે. અશ્રદ્ધાથી સાંભળે.
 - ઘડો ભરવાનાનો પુરુષાર્થ કરે પણ કણ પછી અધૂરો ધમદિશના સાંભળે પણ આચરણમાં કાંઈ નહિ.

- ★ પશુ જેવા - આહાર, નિંદા, મૈથુનનું માત્ર જ્ઞાન. જીવનમાં વિનય, વિવેક, સારા સારના જ્ઞાનનો પ્રભાવ.
- ★ સર્પ જેવા - દૂધ પીએ પણ જેર રૂપે જ પરિણામે.
- ★ પથર જેવા - કુણો કરવા અનેક ઘડા ખાલી કરો અનેક મણ લાકડા બાળો પણ અસર કાંઈ નહિ. ધર્મ સ્વીકારે નહિ.
- ★ રાજહંસ જેવા - દૂધ-પાણીના મિશ્રણમાં ચાંચ બોળી દૂધ પી જાય, પાણી ત્યજી દે, સારું ગ્રહણ કરે, ખરાબ ત્યજી દે.

વક્તાના ચૌદું ગુણ :

- ★ વચન શક્તિશાળી હોય ★ વિષય લાંબો-ટૂંકો કરી શકનાર ★ મધુર બોલનાર ★ અવસરનો જાણકાર
- ★ સત્યવાદી ★ સંદેહ દૂર કરનાર ★ શાસ્ત્રજ્ઞ ★ વિવેચક (હાજર જવાબી) ★ સંપૂર્ણ શરીરી (વંગમાં ન બોલનાર) ★ શ્રોતાને સંતોષનાર ★ સભા જીતનાર (કંદ્રોલમાં રાખનાર) ★ નિરાભિમાની ★ આચાર શુદ્ધ ★ નિસ્પૃહી.

પ્રતિકમણ શા માટે ? (પડિસિદ્ધાણંકરણો વંદીનું સૂત્ર)

1. જેનો શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે, તે કર્યું માટે.
2. શાસ્ત્રોમાં જે કરવા જેવું કહ્યું તે ન કર્યું માટે.
3. જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વ ઉપર અશદ્ધા કરી માટે.
4. જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વથી વિપરીત પ્રતિપાદન કર્યું માટે.

ભાવ પ્રતિકમણ (કિયા) માટે ૮ સૂચના :

- | | |
|---------------------|---|
| ૧. તત્ત્વિતા | - ચિત્તને સૂત્ર-કિયામાં જોડવું. |
| ૨. તન્મય | - ચિત્તને સૂત્ર કિયામાં અર્થ-ભાવ ચિંત્વન વાળું કરવું. |
| ૩. તલ્લેશ્ય | - સૂત્ર-કિયાની પ્રવૃત્તિમાં મનને તેવા ભાવવાળું બનાવવું. |
| ૪. તદ્દુધ્યવસિત | - પ્રથમ ગ્રાણથી યુક્ત આત્માને અનુરૂપ અધ્યવસાયવાળો કરવો. |
| ૫. તતીત્ર અધ્યવસાય | - પ્રારંભથી અંત સુધીના પ્રગતિમય આત્મપરિણામ. |
| ૬. તદર્થોપ્યુક્ત | - સૂત્ર-અર્થ-તદ્દુધ્યભય ગ્રાણથી યુક્ત લક્ષણવાળા થવું. |
| ૭. તદર્પિતકરણ | - મનથી ચિંત્વન-વચનથી સૂત્રોચ્ચાર-કાયાથી મુદ્રા આદીમાં ઉપયોગવાન. |
| ૮. તદ્દ્બાવના ભાવિત | - પૂર્વે કરેલી ભાવ કિયામાં વધુને વધુ શુદ્ધ-તન્મય થવું. |

કાઉસર્ગ્ગ કરવાના કારણો, નિભિતો :

- ★ ગમણાગમણથી (ઈયર્પથિકી કિયા) થયેલ પાપોની શુદ્ધિ માટે.
- ★ પ્રભુને વંદન કરવાના નિભિતે. (વંદણ વતીયાએ)
- ★ પ્રભુની ચંદનાદિ દ્વારા પૂજા-ભક્તિ કરવા. (પૂઅણ વતીયાએ)

- ★ પ્રભુની આભરણાદિથી સત્કાર કરવા. (સક્કાર વતીયાએ)
- ★ પ્રભુનું સ્તવન, વિનયાદિથી સન્માન કરવા. (સમ્માશ વતીયાએ)
- ★ સમ્યક્તવની પ્રાપ્તિ-લાભ માટે (બોહિલાભ વતીયાએ)
- ★ જન્મ મરણાદિ ટાળી મોક્ષ પ્રાપ્તિ માટે (નિરૂપસર્ગ વતીયાએ)
- ★ અધિષ્ઠાયાકાદિ દેવોનો સ્મરણ માટે.

આર્ત (દુર્ધ્વાન) ધ્યાનના પ્રકાર :

(આઉર પચ્ચકખાણ, પચ્ચના સૂત્રમાં કહેલ આર્ત - રૌત્રધ્યાનના પ્રકાર)

- અજ્ઞાન ધ્યાન	- અનાચાર ધ્યાન	- કુદર્શન ધ્યાન	- કોધ ધ્યાન
- માન ધ્યાન	- માયા ધ્યાન	- લોભ ધ્યાન	- રાગ ધ્યાન
- અપ્રીતિ ધ્યાન	- મોહ ધ્યાન	- ઈચ્છા ધ્યાન	- મિથ્યા ધ્યાન
- મૂર્ખી ધ્યાન	- શંકા ધ્યાન	- કંદ્ધા ધ્યાન	- ગૃહિ ધ્યાન
- આશા ધ્યાન	- તૃપ્તા ધ્યાન	- કૃધા ધ્યાન	- પથિ ધ્યાન
- વિષમમાર્ગ ધ્યાન	- નિંદા ધ્યાન	- નિદાન ધ્યાન	- સ્નેહ ધ્યાન
- કામ ધ્યાન	- અપમાન ધ્યાન	- કલહ ધ્યાન	- યુદ્ધ ધ્યાન
- નિયુદ્ધ ધ્યાન	- સંગ ધ્યાન	- સંગ્રહ ધ્યાન	- વ્યવહાર ધ્યાન
- ક્યવિક્ય ધ્યાન	- અનર્થદંડ ધ્યાન	- આભોગ ધ્યાન	- અનાભોગ
ધ્યાન			
- ઋણ ધ્યાન	- વૈર ધ્યાન	- વિતર્ક ધ્યાન	- હિંસા ધ્યાન
- હાસ્ય ધ્યાન	- પ્રહાસ ધ્યાન	- પ્રદેષ ધ્યાન	- પુરુષ ધ્યાન
- પરગાહ્ન ધ્યાન	- પરિગ્રહ ધ્યાન	- પરપરિવાદ ધ્યાન	- પરદૂષણ ધ્યાન
- આરંભ ધ્યાન	- સંરંભ ધ્યાન	- પાપ ધ્યાન	- અધિકરણ
ધ્યાન			
- અસમાધિ મરણ ધ્યાન	- કર્મોદય પ્રત્યય ધ્યાન	- ઋદ્ધિગારવ ધ્યાન	- રસગારવ ધ્યાન
- સાતાગારવ ધ્યાન	- અવિરહ ધ્યાન	- અમુક્તિ મરણ ધ્યાન	

૭ લેશ્યાવાળા જીવોની પરિણતિ-વિચાર

- ★ કૃજ્ઞા લેશ્યા
 - ખાતાં, પીતાં, ઉઠતાં, બેસતાં રૌત્ર સ્વભાવી હોય.
 - નિમિત્તથી કે નિમિત્ત વગર કોધ કરનારો હોય.
 - મત્સર, ઈર્ષા, અદેખાઈ, આદિથી સ્વપર ઘાતક વૃત્તિવાળો હોય.
 - વૈર વિરોધી, મારફાટ આદિથી ઘેરાયેલ હોય.
 - નિર્ધશ પરિણામી, દયારહિત હોય.

- ★ નીલ લેશ્યા
 - પારકાના કામો કરવામાં પ્રમાદી.
 - કામ, કોધના કારણે મંદ બુદ્ધિવાળો.
 - પરસ્થીમાં નિર્જજ્ઞ પ્રકારે આસક્ત.
 - પોતાના-પારકાને ઠગનાર. - ભયગ્રસ્ત.
 - ★ કાપોતલેશ્યા
 - શોક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિથી ગ્રસ્ત.
 - પ્રતિક્ષણે મુખમાં રોષ, આવેશના શબ્દોચ્ચાર.
 - સ્વ પ્રસંશામાં જ વ્યસ્ત.
 - ★ તેજોલેશ્યા
 - નવી નવી વિદ્યાનો વ્યસંગી.
 - કરુણા, દયા, પ્રેમ, સદ્બુદ્ધિનો વારસદાર.
 - કાર્યકાર્ય, ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેયનો વિવેક બુદ્ધિથી વિચારક.
 - સુખ-દુઃખ, લાભા લાભમાં સંતોષી.
 - ★ પદ્મલેશ્યા
 - ક્ષમા પ્રધાન જીવન.
 - મેળવેલી કે મળેલી વસ્તુના ત્યાગ માટે રૂચીવાળો.
 - દેવ, ગુરુ, ધર્મનો ઉપાસક.
 - બાહ્ય-અભ્યંતર જીવનમાં પવિત્ર.
 - પ્રસંગ ચિંતિ.
 - ★ શુક્લલેશ્યા
 - રાગ-દ્વેષ, વિષય-કષાય વિનાનો.
 - શોક, સંતાપ, પરનિદ્ધારિ દૂષણ વિનાનો.
 - પરમાત્મ ભક્તિ-ઉપાસના-સંપત્તિની દૃચ્છિવાળો.
- ચાલો, કાંઈક સમજ લઈએ :
૧. પૃથ્વી - ત્રાણ ઋતુમાં અનેકાનેક સંકટોને સહે છે. (મારે પણ સહનશીલ બનવું જોઈએ.)
 ૨. વાયુ - પ્રાણવાયુ જીવવાનું મહત્વનું સાધન છે. વિષયો-વાસનાઓથી દૂર રાખે છે. (સંસારમાં જળકમળવત્ત જીવવું જોઈએ.)
 ૩. આકાશ - સમરંગી આકાશ જોવું ગમે છે. પણ પલવારમાં બધું વિખરાય થાય છે. (જીવન-યૌવન કણિકાક છે.)
 ૪. પાણી - ગરમ કરો કે મલીન કરો અંતે નિર્મણ ને હંકુ થવાનું. વ્યવહારથી પાણીની કિંમત ઘણી છે. (શરીરને ભલે પવિત્ર-સ્વચ્છ કરો, પણ આત્માને પવિત્ર-સ્વચ્છ કરવાની જરૂર છે.
 ૫. આજિન - વસ્તુને નિર્મણ કરે, પાણું કરે, નાશ કરે છે. (દુર્ગુણો ત્યજી કરી અકર્મા અરૂપી થવા પ્રયત્ન કરો..)

૬. સૂર્ય - ભેદભાવ વગર પ્રકાશ નિયમીત આપે છે. કમળના વિકાસનું કારણ બને છે. (ધર્મ મોક્ષ પ્રાપ્તિનું કારણ છે. દરેક ભવિ જીવ પરમાત્મા બની શકે છે.)
૭. અંદ્ર - સ્વભાવે શાંત છે, પૂર્જિતાને પામે છે. આનંદનો વિષય બને છે.
(પરથી ખસવું છે સ્વમાં વસવું છે શાશ્વત પદ મેળવવું છે.)
૮. સાગર - મહિંડા ઓળંગતો નથી, રતનો ભંડાર છે. અશુભ સંગ્રહતો નથી.
(સુખ-દુઃખથી છલકાવું નથી. અનંત સુખના સ્વામી થવું છે.)
૯. બાળક - સ્વભાવે નિખાલસ છે. નિર્દોષ છે. (મોટા થતા દુર્ગુણી થશે).
(આત્મા નિર્મણ-પવિત્ર છે, શાશ્વત છે. કર્મ ભોગવે છે.)
૧૦. ભ્રમર - અનેક પુષ્પોનો રસ લે છે પણ ડિલામણા આપતો નથી.
(મુનિનું સંયમી જીવન સંસારથી અલિમ જીવન છે)

દાન ધર્મ : (૧) પાંચ પાત્ર :

- ★ રતનપાત્ર - તીર્થકર ★ સુવર્ણપાત્ર - સાધુ વિરતિધર ★ ચાંદીપાત્ર - પ્રતધારી શ્રાવક
- ★ તાંબાનું પાત્ર - સમકિતી શ્રાવક ★ લોઠાનું પાત્ર - સામાન્ય માનવી.

સુખી ધર :

- | | |
|----------------------------------|---------------------------------|
| ★ શરીર - નિરોગી સરકત | ★ ધન - કર્જ દેવા વગરનું |
| ★ પ્રવાસ - યાત્રા વિના ન કરે | ★ ધર્મપત્ની - સુશીલ, સુપાત્ર |
| ★ પુત્ર-પુત્રી - વિનયી આજ્ઞાંકીત | ★ પરિવાર - વિપુલ મૈત્રી ભાવવાળો |
| ★ પ્રતિષ્ઠા - મહાજન વિ.માં સારી | ★ જીવન - સંતોષી ધર્મી |
| ★ વિચાર - પવિત્ર પાપભીરુ | ★ આંખ - બ્રહ્મચર્યથી પવિત્ર. |

જૂદું બોલવાના ૧૪ કારણો :

- ★ કોષ ★ માન ★ કપટ ★ હાંસી ★ લજણ ★ શોક ★ હર્ષોત્સાહ ★ દ્રેષ ★ લોભ ★ રાગ ★ ભય
- ★ કિડા ★ દાક્ષિણ્યતા ★ બહુ બોલવું.

www.jainuniversity.org સાઈટના દસ વરસના ઉપલક્ષ્યમાં on line રજૂ કરે છે. જેને ધર્મના પાયા સ્વરૂપ (ફાઉનેશન)

ત્રિમાસિક પરીક્ષા કોર્સ

આ પરીક્ષા માત્ર ઓનલાઈન (પ્રથમ તબક્કે) રાખવામાં આવેલ છે.

- ◆ ફાઉનેશન કોર્સની વિગત કોર્સવેર બોક્ષમાં ગુજરાતી-દુર્ગલીશ બંને ભાષામાં મૂકવામાં આવેલ છે.
- ◆ ફાઉનેશન કોર્સની પરીક્ષા માટેનું ફોર્મ પરીક્ષાના ૧ મહિના અગાઉ પોતાના ફોટો સાથે પૂરી વિગત સાથે ભરવાનું રહેશે.
- ◆ પ્રત્યેક વર્ષે જાન્યુ. ૨૮ - ૩૦

મે ૩૦ - ૩૧

સપ્ટ. ૨૮ - ૩૦ તારીખ બે દિવસ એકજામ પેપર તમારા ઈમેલ બોક્સ ઉપર મૂકવામાં આવશે. જે નિશ્ચિત ૩૦ સેકન્ડમાં પસંદ કરેલ / ચોઈસેબલ જવાબ ઉપર ક્લિક કરી આપવાનો રહેશે.

◆ જૈન ધર્મની આ પરીક્ષા ફક્ત પોનાના જ્ઞાનની વૃદ્ધિ, પુષ્યની સંવૃદ્ધિ, અને જીવનની શુદ્ધિ માટે રાખવામાં આવેલ છે.

◆ કોઈપણ જાતની ચોરી કે પૂછપરછ કરી જવાબ લખી સર્ટિફિકેટનો મોહ રાખવો નહિ.

પ્રમાણિકતા એ મોટું સર્ટિફિકેટ છે

◆ આ ટર્મમાં પાસ થનારે જ આગળના કોર્સની પરીક્ષા આપી શકશે.

◆ ફેરફાર થનાર જ્ઞાન-પિપાસુ, બીજી-ગીજીવાર ફાઉન્ડેશન કોર્સની પરીક્ષા આપી શકશે.

◆ ફાઉન્ડેશન કોર્સ ફી રૂ. ૧૦૦

◆ ડિપ્લોમા કોર્સ ફી રૂ. ૩૦૦

ભાવાંજલિ...

ભગવાન મહાવીરની અહિસાની છાપ બ્રાહ્મણ ધર્મ પર પડી. આજકાલ યજોમાં પશુભલિ નથી ધરાવાતા. બ્રાહ્મણ ધર્મમાં માંસ-માદિરાનું સેવન બંધ થઈ ગયું. આ જૈન ધર્મનો જ પ્રભાવ છે. - લોકમાન્ય ટિથક

પહેલાં હું માનતો હતો કે મારા વિરોધીઓમાં અજ્ઞાન છે હવે આજે હું વિરોધીઓની નજરે પણ જોઈ શકું છું. મારો અનેકાંતવાદ- સત્ય અને અહિસા - આ દ્વિ-સિદ્ધાંતોનું પરિણામ છે. -મહાત્મા ગાંધીજી

મારો વિશ્વાસ છે કે ભગવાન મહાવીરનો અનેકાંતવાદનો સંદેશ દુનિયાના તમામ જવાઓને મિત્રાવી દેશે અને સમન્વય દ્વારા, શાંતિ, સંતોષ, નિર્ભયતા અને સર્વ સેવાનો યગાનુકૂળ પ્રચાર થશે.

‘મહાવીર’ શબ્દથી શો અર્થ થાય છે ? સર્વત્ર બાપીને, આસુરી શક્તિનો પરાજય કરીને, વિશ્વનું પાલન કરે તે મહાવીર. માતૃભક્તિ, સુખનો ત્યાગ, ભૂતમાત્ર વિષેની અપાર દ્યા અને ઈન્દ્રિયજ્યનો ઉત્કર્ષ બતાવનાર જ્ઞાતપુત્ર વર્ધમાન એ મહાવીર. આર્યજાતિએ સર્વોચ્ચ સદ્ગુણોની જે મનોમય મૂર્તિ કલ્યી છે, જે આદર્શ રચ્યો છે તેને પહોંચનાર વ્યક્તિ તે મહાવીર. વિજય મેળવે તે વીર, આંતરબાધ્ય દુનિયા પર વિજય મેળવે તે મહાવીર. વીર એટલે આર્ય, મહાવીર એટલે અર્હત.

આજે દુનિયા સમક્ષ એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે માનવીને હિંસામાંથી કંઈ રીતે ઉગારી શકાય. હિંસા હિંસકને જ નાશ કરી દે છે. હિંસક શક્ત રાખનારા સ્વયં એ શક્તોથી જ નાશ થાય છે. આપણે ભગવાન મહાવીરના અહિસા અને અનેકાંતના માર્ગ પર ચાલીને જ વિશ્વમાં શાંતિ સ્થાપિત કરી શકીશું.

ભગવાન મહાવીરનો સંદેશઅને તેમના જીવન સંબંધી વધુ માહિતી મેળવવાનું કાર્ય આપણા માટે જ નહીં; પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વનું છે. ‘અહિસા પરમો ધર્મ’નો સંદેશ તેમના અનુભવ અને તપસ્યાનું ફળ છે. ભગવાન મહાવીરના જીવન પરથી ઘ્યાલ આવે છે કે ઘોર તપશ્ચર્યા કર્યા બાદ પણ તેઓ માત્ર તપસ્યી જ રહ્યા ન હતા અથવા તો પ્રાણીઓનાં સુખ-દુઃખ પ્રતિ ઉદાસીન થઈ ગયા ન હતા; બીજાઓ પ્રતિ તેમનો આત્મા દ્યાળું અને સહદ્યી રહ્યો હતો. આવા સહાનુભૂતિપૂર્ણ સ્વભાવને લીધે પ્રાણીઓનાં સુખ-દુઃખ માટે અને જગતના કલ્યાણ માટે તેમણે ઊહુ ચિંતન કર્યું હતું.

જૈન ધર્મના સિદ્ધાંતો મને ખૂબ જ ગમે છે. જો પુનર્જન્મ હોય તો મૃત્યુ પછી મારો જન્મ જૈન કુટુંબમાં થાય એમ ઈચ્છું છું.

જ્યોર્જ બનાડ શો

જૈન ધર્મનું કેત્ર વિશાળ છે, પ્રાણી માત્રને સમાન હક્ક છે, એવી તેમાં વિરલ ભાવના છે. રાજા-મહારાજાથી માંડીને એક સામાન્ય વ્યક્તિ પણ જૈન ધર્મ અંગીકાર કરી શકે છે. ભગવાન મહાવીરે વિશ્વને અહિસાનો અમૂલ્ય સિદ્ધાંત આપ્યો છે. અહિસામાં અપ્રતિમ શક્તિ રહેલી છે. આજના સમયમાં માનવતાની રક્ષાને માટે ભગવાન મહાવીરના ઉપદેશોનું પાલન કરવું અત્યંત હિતાવહ છે.

- જીવાહરલાલ નહેરુ

લાંચ-રુશ્યત, અપ્રામાણિકતા અને અત્યાચાર જરૂર દૂર થઈ શકે, જો આપણે ભવાન મહાવીરના મહાન અને પ્રભાવશાળી સિદ્ધાંતોનું પાલન કરીએ. ભગવાન મહાવીરે કહ્યું છે તેમ આપણા બધા દોષો અને નબળાઈઓને દૂર કરીએ, તો સમસ્ત જગત આપો આપ સુધી જાય.

ભગવાન મહાવીરે આપણને એ જ શીખવ્યું અને જે ભારતીય સંસ્કૃતિની મોટામાં મોટી બેટ છે તે છે સમતા અને સહિષ્ણુતા. આપણે ફક્ત મનુષ્ય માટે જ શાંતિ ઈચ્છા નથી, પ્રાણીમાત્ર માટે પણ લાવવી છે; અને આ શાંતિની સ્થાપના ભગવાન મહાવીરના મુખ્ય સિદ્ધાંત અહિસા અને અપરિગ્રહથી જ કરી શકાય તેમ છે.

- શ્રીમતી ઈન્દ્રિય ગાંધી

ભગવાન મહાવીરે બુલંદ અવાજે એવો સંદેશો ફેલાવ્યો કે ધર્મ માત્ર સામાજિક રૂઢિઓનું પાલન કરવાથી નહીં, પરંતુ સત્યમાર્ગનો આશ્રય લેવાથી પ્રામ થાય છે. ધર્મમાં મનુષ્ય મનુષ્ય વચ્ચે કોઈ સ્થાયી ભેદભાવ ન રાખી શકાય. જોતાં આશ્રય થાય છે કે ભગવાન મહાવીરના આ ઉપદેશો સમાજમાં ઘર કરી ગયેલી આ ભેદરેખાને ઘણી જ વ્યરિતતાથી નાચ કરી નાખી; અને સમગ્ર દેશને પોતાને વશ કરી લીધો, જીતી લીધો.

ભગવાન મહાવીરને ‘જિન’ અર્થાત્ વિજેતાનું પદ પ્રામ થયું હતું. એ માટે તેઓએ ન તો કોઈ દેશ જીતો હતો કે ન તો કોઈ યુદ્ધ લડ્યા હતા; પરંતુ તેઓએ પોતાની આંતરવૃત્તિઓ સાથે સંગ્રામ ખેલી પોતાની જાત ઉપર વિજય પ્રામ કર્યો હતો.

ભગવાન મહાવીર આપણી સામે એક એવા આદર્શરૂપે છે, જેમણે સંસારનાં બધાં પદાર્થોનો પરિત્યાગ કરી ભૌતિક બંધનોથી છૂટકારો મેળવ્યો. આ રીતે, તેઓ આત્મત્વના ઉત્કર્ષ માટેનો અનુભવ મેળવવામાં વિજયી બન્યા હતા.

આ દેશ, તેમના ઈતિહાસના મારંભથી જ આજ સુધી આ આદર્શ પર ખડો છે. -સર્વપલ્લી
રાધાકૃષ્ણન